



**પપ મો**  
**વાર્ષિક અહેવાલ**  
સને : ૨૦૨૫-૨૦૨૬



**શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.**

“વેપાર ભવન”, ટાવર ચોક, બોટાદ - ૩૬૪૭૧૦.

ફોન : (૦૨૮૪૯) ૨૫૨૨૫૭

**Shree Botad Mercantile Co-Operative Bank Ltd.**

Vepar Bhavan, Tower Chowk, Botad - 364710

Ph.(02849) 252257

E-mail : [bmcoblal1@gmail.com](mailto:bmcoblal1@gmail.com)

Web : [www.sbmbli.bank.in](http://www.sbmbli.bank.in)

IFSC Code : GSCB0UBOTAD



# શ્રી બોટાદ મહંતાશિલ કો-ઓપરેટીવ બેંક લી.

- રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લા.નં. : યુ.બી.ડી.જી.જે. ૫૩૫ પી. તા.૦૪-૦૯-૧૯૮૬
- જિલ્લા રજીસ્ટ્રાર રજી. નં. : સે.૬૮૭૭/૧૯૭૨, તા.૩૦-૦૩-૧૯૭૨
- જી.એસ.ટી.નં. : 24AAAAB0709J1Z8



## બોર્ડ ઓફ ડીરેક્ટર્સ



શ્રી ધર્મેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર વડોદરીયા  
ચેરમેન



શ્રી ભુપતરાય દામોદરદાસ શાહ  
વાઈસ ચેરમેન



શ્રી અનીલકુમાર કનેયાલાલ શેઠ  
ડીરેક્ટર



શ્રી હસમુખલાલ શીવલાલ શાહ  
ડીરેક્ટર



શ્રી પ્રતિકભાઈ જયેશચંદ્ર વડોદરીયા  
ડીરેક્ટર



શ્રી સુધીરભાઈ હર્ષદભાઈ વાઘેલા  
ડીરેક્ટર



શ્રી ભરતભાઈ નવીનચંદ્ર ગોપાણી  
ડીરેક્ટર



શ્રી દિનેશભાઈ શાંતિલાલ શાહ  
ડીરેક્ટર



શ્રી અલ્કેશભાઈ અંબકલાલ શેઠ  
ડીરેક્ટર



શ્રીમતી ધ્વનિબેન ધર્મેન્દ્રકુમાર વડોદરીયા  
ડીરેક્ટર



શ્રીમતી છાયાબેન કમલેશભાઈ ચીકાણી  
ડીરેક્ટર



શ્રી નચિકેતભાઈ ગુલાબભાઈ વડોદરીયા  
પ્રોફેશનલ ડીરેક્ટર

**:: કાયદાના માનદ્ સલાહકાર ::**  
વકીલ શ્રી પરેશકુમાર કૃષ્ણલાલ વડોદરીયા  
વકીલ શ્રી ચૈતન્યભાઈ રવિશંકરભાઈ મહેતા  
વકીલ શ્રી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ દવે



શ્રી ભાવેશભાઈ બિપીનભાઈ શેઠ  
પ્રોફેશનલ ડીરેક્ટર



શ્રી જયદેવભાઈ મનુભાઈ ચૌહાણ  
મેમ્બર

**કમલ સી. મહેતા એન્ડ કંપની.**  
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણિત અન્વેષક)  
FRN 104614W / M.NO.129801

## વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી બેંકના સર્વે સભાસદશ્રીઓને જણાવવામાં આવે છે કે બેંકની ૫૫મી વાર્ષિક સાધારણ સભા તારીખ : ૧૯-૦૭-૨૦૨૬ને, રવિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સ્વાધ્યાય હોલ, લાઘણેરી ઉપર, નદી કિનારા, બોટાદ ખાતે મળશે, જે વખતે નીચેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, આપ સર્વેને સમયસર હાજર રહેવા વિનંતી છે.

### કાર્ય સૂચિ :

૧. ગઈ તા. ૨૦-૦૭-૨૦૨૫ ના રોજ મળેલ સાધારણ સભાની શુધ્ધ નોંધ વાંચી મંજૂર કરવા.
૨. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના વર્ષના ઓડીટ રીપોર્ટના ખુલાસા આપવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સતા આપવા.
૩. વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના વર્ષ માટે બહારથી લેવાના કરજની હદ મુકરર કરવા અંગે.
૪. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સુચવેલ પેટા નિયમમાં સુધારા તથા પેટા નિયમમાં ઉમેરો મંજૂર કરવા બાબત.
૫. તા. ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થયેલ વર્ષનો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો અહેવાલ તથા બેંકના ઓડીટ થયેલા હિસાબો, નફા-નુકશાન ખાતું તથા સરવૈયું મંજૂર કરવા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ મુજબ ચોખ્ખા નફાની ફાળવણી મંજૂર કરવા.
૬. પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય જે કાંઈ રજુ થાય તે.

બોટાદ

તારીખ : ૨૩-૦૬-૨૦૨૬

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી,

જે. એમ. ચૌહાણ

મેનેજર

### નોંધ :

- કોરમના અભાવે મુલતવી રહેલી સભા, સભાનાં સમય પછી અડધી કલાકમાં તે જ સમયે અને તે જ સ્થળે મળશે, જેને કોરમનો બાદ આવશે નહીં.
- આ વાર્ષિક અહેવાલ સાધારણ સભામાં અચુક સાથે લાવવા વિનંતી.



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## પપ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૫-૨૦૨૬

માનનીય સભાસદ ભાઈઓ તથા બહેનો,

આપના સહુના સાથ સહકારના કારણે બેંક તેની ઉજ્જવળ અને યશસ્વી કારકીર્દીના ૫૫ વર્ષ પુરા કરી ૫૬ માં વર્ષમાં શુભ પ્રસ્થાન કરે છે. તે પ્રસંગે બેંકની ૫૫ મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું.

આપણી બેંકની ૫૫મી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌને આવકારતા તેમજ તા. ૩૧.૦૩.૨૦૨૬ના રોજ પુર્ણ થતા બેંકના વાર્ષિક અહેવાલ, ઓડિટેડ પાકુ સરવૈયું તથા નફા - નુકશાન પત્રક આપ સમક્ષ રજુ કરતા આનંદ અનુભવું છું.

### ૧. ફંડો :

કોઈપણ નાણાંકીય વિકાસ અને સધ્ધરતા તેના અનામત ભંડોળ ઉપરથી ખ્યાલ આવે છે. બેંકનાં રીઝર્વ ફંડ તથા અન્ય વિવિધ ફંડો કુલ રૂ. ૨૫૪૬.૧૨ લાખ છે. જેનો આંક ભરપાઈ થયેલ શેર ભંડોળથી ઘણો જ ઉચો છે. જે બેંકની સધ્ધરતા દર્શાવે છે. બેંકના સભાસદોની સંખ્યા ૩૦૩૧ છે તથા નોમીનલ સભાસદની સંખ્યા ૧૨૪ છે.

### ૨. થાપણો :

બેંકની થાપણોએ બેંકમાં લોકોના વિશ્વાસનું પ્રતિક છે. વર્ષ દરમિયાન થાપણ રૂ. ૫૭૭૮.૭૫ લાખ થયેલ છે. બેંકીંગ ક્ષેત્રની તીવ્ર હરિફાઈ છતાં થાપણદારોએ બેંક પ્રત્યે અડગ, અતુટ વિશ્વાસ દાખવી અમોને પ્રેરકબળ પુરૂ પાડેલ છે. જે બદલ બેંકનાં વિકાસમાં સહભાગી સભાસદો, થાપણદારો તથા શુભેચ્છકોનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

### ૩. ધિરાણો :

બેંકનું તા. ૩૧.૦૩.૨૦૨૬નું કુલ ધિરાણ રૂ. ૨૦૫૫.૮૪ લાખ છે.

ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન પણ બેંકની વસુલાતની કામગીરી પ્રમાણમાં સંતોષકારક રહેલ છે. બેંકની N.P.A. ની વસુલાત માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીઓ તથા બેંક સ્ટાફની સંયુક્ત રીતે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જે પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં રૂ. ૪૬.૦૬ લાખની રીકવરી સાથે તા. ૩૧.૦૩.૨૦૨૬ ના રોજ રૂ. ૬૫૪.૮૬ લાખ ગ્રોસ N.P.A. થવા જાય છે. જે ધિરાણના ૩૧.૮૫ % થાય છે. વિશેષ બેંક દ્વારા N.P.A. વસુલાત માટે ધનિષ્ઠ પગલા લેવામાં આવેલ જેના ફળ સ્વરૂપે N.P.A. ખાતા ઉપરનું વ્યાજ તથા પ્રોવિઝન બાદ કરતા નેટ N.P.A. તા. ૩૧.૦૩.૨૦૨૬ના રોજ ૦ % છે.

### ૪. થાપણ સુરક્ષા કવચ :

આપ જાણો છો તે પ્રમાણે આપણી બેંકની થાપણો વિમા સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી છે. જેથી રૂપિયા પાંચ લાખ સુધીની થાપણ વિમાથી સંપૂર્ણ સુરક્ષિત છે. બેંક દ્વારા વિમાનું અર્ધ વાર્ષિક પ્રિમિયમ તા. ૦૭.૦૪.૨૦૨૬ ના રોજ DICGC ને ચુકવી દેવામાં આવ્યું છે. જે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના સમયને આવરી લે છે. આપણી બેંકની મિલ્કતો - મૂડી, તથા રીઝર્વ ફંડ વિગેરેને ગણતરીમાં લેતા ગ્રાહકોની થાપણો ૧૦૦ % સુરક્ષિત છે અને વ્યાજ સહીત ચુકવવાની ક્ષમતા છે એમ હું આપને પુરા વિશ્વાસ સાથે ખાતરીપૂર્વક જણાવું છું.

### ૫. ઓડીટ :

બેંકનું વર્ષ ૨૦૨૫-૨૬નું કન્કરન્ટ ઓડિટ પ્રકાશ ખીનવેસરા એન્ડ એસોસીએટ્સ દ્વારા કરેલ છે તેમજ સ્ટેચ્યુટરી ઓડીટ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ કમલ સી. મહેતા એન્ડ કંપની (FRN No.104614W) અમદાવાદ મારફતે કરવામાં આવેલ છે. તેઓના રીપોર્ટ અનુસાર બેંકના કામકાજથી સંતોષ વ્યક્ત કરેલ છે અને તેઓએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર બેંકના સરવૈયા / નફા-નુકશાન પત્રક તથા નોટસ ઓન એકાઉન્ટ પ્રમાણિત કરી આપતા આપશ્રી સમક્ષ વાર્ષિક સાધારણ સભામાં મંજૂરી માટે રજુ કરેલ છે. જે અહેવાલમાં વિસ્તૃત સ્વરૂપે દર્શાવેલ છે.

### ૬. મૂડી પર્યાપ્તતા (CRAR) :

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોની મિલ્કતો સામેનાં સંભવીત જોખમોને પહોંચી વળવા માટેની મૂડી પર્યાપ્તતાનું ધોરણ (Capital Risk Weighted Assets Ratio [CRAR]) લાગુ પાડવામાં આવેલ છે. તા. ૩૧.૦૩.૨૦૨૬ નાં રોજ પુરા થતા વર્ષનાં અંતે આપણી બેંકનો આ રેસીયો ૭૮.૪૬ % છે. જે આપણી બેંક માટે સારી બાબત છે.

### ૭. ડિવીડન્ડ :

બેંકના ભરપાઈ થયેલ શેર ભંડોળ ઉપર ચાલુ વર્ષે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સભાસદોને ૬% ડિવીડન્ડ આપવા ભલામણ કરેલ છે. આપ તેને મંજૂર કરશો તેવી આશા છે.

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



## ૮. ચોખ્ખા નફાની ફાળવણી :

અહેવાલના વર્ષ દરમિયાન થાપણો પરનું વ્યાજ, આકસ્મિક જોગવાઈ, ડોનેશન એન.પી.એ. માટેની જોગવાઈ, સંચાલન ખર્ચ, ઘસારો, કર્મચારીના પગાર - ભથ્થા તથા DICGC પ્રીમીયમ વિગેરે ખર્ચાઓ બાદ જતા જેની બેન્કનાં પેટા નિયમો અને ગુજરાત સરકારશ્રીની કાયદા અનુસાર નિયેની વિગતે ફાળવણી કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભલામણ કરે છે. જેને આપ સર્વની બહાલી મળી રહેશે. તેવી આશા રાખું છું.

## ચોખ્ખો નફો ::

### કલમ ૪૭(બ) મુજબ ફાળવણી

|                                                       |        |                           |
|-------------------------------------------------------|--------|---------------------------|
| ૧. રીઝર્વ ફંડ (કાયદા અનુસાર)                          | ૨૫ ટકા | રૂ. ૨૬,૫૬,૮૮૧ - ૬૨        |
| ૨. બેંક એન્ડ ડાઉટફુલ ડેબ્ટ રીઝર્વ ફંડ                 | ૧૫ ટકા | રૂ. ૧૫,૮૪,૧૮૪ - ૮૭        |
| ૩. શિક્ષણ સંઘનો ફાળો (સ્વૈચ્છિક)(મહત્તમ મર્યાદા મુજબ) | ૧ ટકા  | રૂ. ૫૦,૦૦૦ - ૦૦           |
| ૪. ડિવીડન્ડ ખાતે                                      | ૬ ટકા  | રૂ. ૬,૨૦,૬૭૦ - ૦૦         |
|                                                       |        | <b>રૂ. ૪૮,૨૧,૮૫૬ - ૫૯</b> |

### બાકી રહેતો નફો

### કલમ ૪૭(ક) મુજબ

|                                 |        |                           |
|---------------------------------|--------|---------------------------|
| ૧. બિલ્ડીંગ ફંડ                 | ૨૦ ટકા | રૂ. ૧૧,૪૧,૨૨૧ - ૮૮        |
| ૨. સાર્વજનિક હેતુ ફંડ           | ૦૫ ટકા | રૂ. ૨,૮૫,૩૦૫ - ૫૦         |
| ૩. સહકાર અને બેન્કીંગ વિકાસ ફંડ | ૦૫ ટકા | રૂ. ૨,૮૫,૩૦૫ - ૫૦         |
| ૪. સભાસદ કલ્યાણ ફંડ             | ૧૫ ટકા | રૂ. ૮,૫૫,૮૧૬ - ૪૮         |
| ૫. કર્મચારી કલ્યાણ ફંડ          | ૦૨ ટકા | રૂ. ૧,૧૪,૧૨૨ - ૨૦         |
| ૬. ઇન્વેસ્ટમેન્ટ ફલ્ક્યુએશન ફંડ | ૨૦ ટકા | રૂ. ૧૧,૪૧,૨૨૧ - ૮૮        |
|                                 |        | <b>રૂ. ૩૮,૨૩,૦૬૩ - ૬૫</b> |

**કુલ રૂ. ૮૭,૪૪,૯૫૦ - ૨૪**

બાકી રહેતો નફો રૂ. ૧૮,૮૩,૦૧૬ - ૨૫ જે ઇન્વેસ્ટમેન્ટ ફલ્ક્યુએશન ફંડ ખાતે લઈ ગયા. બેન્કના સભાસદોના હિતમાં સભાસદ મરણોત્તર સહાય યોજના વર્ષ દરમિયાન ૨૮ સભાસદોનું અવસાન થતા બેન્ક તરફથી વારસદારોને રૂ. ૨,૮૦,૦૦૦.૦૦ સહાય ચુકવવામાં આવી છે.

## આભાર દર્શન :

વિતેલા વર્ષો દરમિયાન બેન્કનાં કામકાજમાં સાથ સહકાર આપનાર સર્વે સભાસદશ્રી, થાપણદારો, ગ્રાહકો, સર્વેનો બેન્ક વતી આભાર માનું છું.

મારા સહકાર્યકરોએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સર્વસભ્યોએ ઉત્સાહસભર કામ કર્યું છે. તે બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

બેન્કના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરે છે. જે બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું.

બેન્કના રોજિંદા કાર્યમાં સહકાર અને માર્ગદર્શન આપવા બદલ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, શ્રી જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ, બોટાદ અન્ય સહકારી બેન્કો, ભાવનગર ડી.કો.ઓ.બેન્ક લી. બોટાદ, ગુજરાત અર્બન બેન્કસ ફેડરેશન અમદાવાદ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક લી અમદાવાદ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બોટાદ, આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક બોટાદ, આઈ.ડી.બી.આઈ બેન્ક બોટાદ તેમજ રાજ્યના સહકારી ખાતા તેમજ ઓડીટરશ્રી સર્વનો આભાર માનું છું.

આગામી વર્ષમાં બેન્ક આપ સર્વેના અવિરત સાથ સહકારથી વધુ પ્રગતિ સાધે તેવી આશા અને શુભેચ્છા સાથે વિરમું છું.

આભાર .....

ધન્યવાદ .....

જય સહકાર .....

આપનો સહયોગી  
શ્રી ધર્મેન્દ્રભાઈ પી. વડોદરીયા  
ચેરમેન



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

તારીખ : ૩૧-૦૩-૨૦૨૫ના રોજ પુરા થતા વર્ષનું નફા-નુકશાન ખાતું

| તા. ૩૧-૦૩-૨૦૨૫ | ખર્ચ                                                                               | તા. ૩૧-૦૩-૨૦૨૫ |
|----------------|------------------------------------------------------------------------------------|----------------|
| ૨,૩૮,૮૮,૮૨૨-૦૦ | (૧) થાપણો તથા કરજ ઉપર ચુકવેલ વ્યાજ<br>ક. થાપણો ઉપર ચુકવેલ વ્યાજ<br>(શેડ્યુઅલ - ૧૫) | ૨,૪૫,૧૬,૦૭૨-૦૦ |
| ૧,૮૮૮-૦૦       | ખ. કરજ ઉપર ચુકવેલ વ્યાજ                                                            | ૮૬૧-૦૦         |
| ૧,૨૮,૪૬,૮૫૬-૦૦ | (૨) સ્ટાફ - પગાર - ભથ્થા વિગેરે<br>(શેડ્યુઅલ - ૧૬(૧))                              | ૧,૨૭,૩૯,૯૦૧-૦૦ |
| ૬,૨૧,૪૧૧-૧૧    | (૩) એ.મકાનભાડુ-ટેક્સ-વિમો-વિજળી ખર્ચ<br>(શેડ્યુઅલ - ૧૬(૨))                         | ૨,૧૩,૪૦૯-૦૦    |
| ૮,૮૦,૮૧૫-૨૬    | એ.ઈન્સ્યુરન્સ (શેડ્યુઅલ - ૧૬(૩))                                                   | ૯,૮૧,૪૨૪-૫૫    |
| ૩,૪૬,૮૪૮-૦૦    | (૪) લીગલ ચાર્જસ                                                                    | ૧,૭૩,૧૯૪-૦૦    |
| ૪૦,૫૩૬-૭૦      | (૫) તાર-ટપાલ ખર્ચ<br>(શેડ્યુઅલ - ૧૬(૪))                                            | ૯૦,૯૦૯-૯૪      |
| ૧,૫૭,૫૦૦-૦૦    | (૬) ઓડીટર ફી                                                                       | ૨,૦૪,૬૦૬-૦૦    |
| ૨,૮૧,૩૧૦-૦૦    | (૭) ક. ઘસારા ખર્ચ (ફર્નિચર, બિલ્ડીંગ અન્ય)<br>(શેડ્યુઅલ - ૧૬(૫))                   | ૨,૯૨,૦૨૦-૦૦    |
| ૩૬,૭૪૫-૦૧      | ખ. રીપેરીંગ ખર્ચ<br>(શેડ્યુઅલ - ૧૬(૬))                                             | ૧,૬૭,૦૬૨-૯૩    |
|                | (૮) સ્ટેશનરી, પ્રીન્ટીંગ અને જાહેરાત ખર્ચ                                          |                |
| ૧,૨૮,૫૮૨-૦૩    | ક. પ્રીન્ટીંગ સ્ટેશનરી                                                             | ૧,૯૮,૩૯૯-૦૪    |
| ૧,૦૪,૪૧૫-૦૦    | ખ. જાહેરાત ખર્ચ (શેડ્યુઅલ - ૧૬(૭))                                                 | ૧,૦૩,૭૩૧-૦૦    |
| ૨૮,૨૩,૪૪૦-૮૪   | (૯) અન્ય ખર્ચ (શેડ્યુઅલ - ૧૬(૮))                                                   | ૧૧,૦૫,૩૮૮-૦૦   |
|                | ફર્નિચર ફિક્સચર ડેડ સ્ટોક લોસ CCTV કેમેરા                                          | ૩૦,૬૨૮-૦૮      |
|                | (૧૦) પ્રોવિઝન તથા ઇન્કમટેક્સ                                                       |                |
| ૮,૭૬,૩૫૦-૦૦    | ક. બેંક એન્ડ ડાઉટ ફુલ રીઝર્વ ફંડ                                                   | ૧,૧૩,૦૦૦-૦૦    |
| —              | ખ. ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રિએશન ફંડ                                                     | ૭૫,૩૭,૦૦૦-૦૦   |
| ૭,૦૦,૦૦૦-૦૦    | ગ. સાયબર સિક્યુરીટી ફંડ (પ્રોવિઝન)                                                 | ૦-૦૦           |
| ૩૬,૦૨,૧૮૦-૦૦   | ઘ. ઇન્કમટેક્સ (પ્રોવિઝન)                                                           | ૩૪,૦૧,૬૩૬-૦૦   |
|                | ગઈ સાલ/ ચાલુ સાલનો નફો                                                             |                |
|                | સરવૈયામાં લઈ ગયા તે                                                                |                |
| ૧,૦૫,૨૪,૨૦૨-૩૫ | ૧. ચોખ્ખો નફો                                                                      | ૧,૦૬,૨૭,૮૬૬-૪૮ |
| ૩૫,૦૦,૦૦૦-૦૦   | ૨. એક્સેસ રીઝર્વ/પ્રોવિઝન બીલોવ લાઈન                                               | ૦-૦૦           |
| ૬,૧૪,૭૪,૦૩૪-૪૦ | કુલ સરવાળો                                                                         | ૬,૨૪,૯૭,૨૧૦-૦૩ |

અમદાવાદ

તા. ૧૨-૦૫-૨૦૨૬

જે. એમ. ચૌહાણ

મેનેજર

કમલ સી. મહેતા એન્ડ કંપની.

(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણીત અન્વેષક)

FRN 104614W / M.NO.129801

UDIN NO.26129801KTBZA2454

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



તારીખ : ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થતા વર્ષનું નફા-નુકશાન ખાતું

| તા. ૩૧-૦૩-૨૦૨૫     | આવક                                                            | તા. ૩૧-૦૩-૨૦૨૬ |
|--------------------|----------------------------------------------------------------|----------------|
| ૫,૭૬,૭૩,૫૭૧-૮૮ (૧) | ધિરાણો તથા રોકાણો ઉપર વ્યાજ આવક<br>(શેડ્યુઅલ - ૧૩)             | ૫,૫૪,૭૮,૧૬૨-૭૪ |
| ૩૬,૬૨૭-૪૭ (૨)      | કમીશન<br>ક. કમીશન એક્ચ્યુઅલ બ્રોકરેજ                           | ૩૪,૨૨૪-૭૨      |
| ૧૦,૨૮૦-૦૦          | ખ. ડીવીડન્ડ આવક                                                | ૧૦,૨૮૦-૦૦      |
| ૭,૭૬,૫૪૪-૮૫ (૩)    | અન્ય આવક (શેડ્યુઅલ - ૧૪)                                       | ૭,૫૬,૦૩૨-૫૭    |
| ---                | (૪) રોકાણોના વેચાણ પર નફો                                      | ---            |
| ---                | ક. મિલ્કત વેચાણ પર નફો                                         | ---            |
| ---                | ખ. રોકાણોના વેચાણ પર નફો                                       | ---            |
| -૫,૨૩,૦૦૦-૦૦       | ગ. રોકાણોના વેચાણ પર નુકશાન                                    | -૭,૭૩,૫૦૦-૦૦   |
| ---                | ઘ. લોકર બ્રેક ઓપન ચાર્જ                                        | ---            |
| ---                | લોસ ફોમ સીક્યુરીટી                                             | ---            |
| ૩૫,૦૦,૦૦૦-૦૦       | એક્સેસ રીઝર્વ/પ્રોવિઝન બીલોવ લાઈન<br>ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રીસીએશન | ૬૯,૯૨,૦૦૦-૦૦   |
| ૬,૧૪,૭૪,૦૩૪-૪૦     | કુલ સરવાળો                                                     | ૬,૨૪,૯૭,૨૧૦-૦૩ |

અમદાવાદ

તા. ૧૨-૦૫-૨૦૨૬

જે. એમ. ચૌહાણ

મેનેજર

કમલ સી. મહેતા એન્ડ કંપની.

(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણીત અન્વેષક)

FRN 104614W / M.NO.129801

UDIN NO.26129801KTBZA2454

શ્રી ધર્મેન્દ્રકુમાર પી. વડોદરીયા

ચેરમેનશ્રી

શ્રી ભુપતરાય ડી. શાહ

વાઈસ ચેરમેનશ્રી

:: બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ::

શ્રી અનિલભાઈ કે. શેઠ

શ્રી પ્રતિકભાઈ જે. વડોદરીયા

શ્રી ભરતભાઈ એન. ગોપાણી

શ્રી અલ્કેશભાઈ ટી. શેઠ

શ્રીમતી ધ્વનિબેન ડી. વડોદરીયા

શ્રી નયીકેતભાઈ જી. વડોદરીયા

શ્રી હસમુખભાઈ એસ. શાહ

શ્રી સુધીરભાઈ એચ. વાઘેલા

શ્રી દિનેશભાઈ એસ. શાહ

શ્રી છાયાબેન કે. ચીકાણી

શ્રી ભાવેશભાઈ બી. શેઠ



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

**:: એનેક્ષર ::**

| શેડ્યુઅલ-૧૩ વ્યાજ ઉપર ધિરાણો તથા રોકાણો ઉપર |                            |                       |
|---------------------------------------------|----------------------------|-----------------------|
| ક્રમ                                        | વિગત                       | તા. ૩૧-૦૩-૨૦૨૬        |
| ૧                                           | વ્યાજ આવક ધિરાણ ઉપર        | ૧,૫૧,૩૨,૭૬૭-૫૩        |
| ૨                                           | વ્યાજ આવક બેન્કસ એફ.ડી.આર. | ૨૧,૫૫,૫૫૧-૦૦          |
| ૩                                           | વ્યાજ આવક જી.ઓ.આઈ. સીક્યુ. | ૩,૮૧,૮૮,૮૪૪-૨૧        |
|                                             |                            | <b>૫,૫૪,૭૮,૧૬૨-૭૪</b> |

| શેડ્યુઅલ-૧૪ અન્ય આવક ઉપર |                       |                    |
|--------------------------|-----------------------|--------------------|
| ક્રમ                     | વિગત                  | તા. ૩૧-૦૩-૨૦૨૬     |
| ૧                        | પી.જી.વી.સી.એલ. કમીશન | ૮૧,૫૫૫-૦૦          |
| ૨                        | એસ.એમ.એસ. આવક         | ૨૬,૦૪૦-૩૨          |
| ૩                        | પરચુરણ આવક            | ૬૩૮-૦૫             |
| ૪                        | સર્વિસ ચાર્જ          | ૨,૮૬,૨૦૩-૮૮        |
| ૫                        | લોકર ભાડા આવક         | ૩,૪૦,૫૮૦-૫૩        |
| ૬                        | કેશ હેન્ડલીંગ ચાર્જ   | ૨૦,૬૦૦-૬૮          |
| ૭                        | શેર ટ્રાન્સફર ફી આવક  | ૪૦૩-૦૦             |
|                          |                       | <b>૭,૫૬,૦૩૨-૫૭</b> |

| શેડ્યુઅલ-૧૫ થાપણો ઉપર ચુકવેલ વ્યાજ |                           |                       |
|------------------------------------|---------------------------|-----------------------|
| ક્રમ                               | વિગત                      | તા. ૩૧-૦૩-૨૦૨૬        |
| ૧                                  | સેવિંગ્સ ખાતાઓ ઉપર        | ૭૮,૦૬,૮૦૪-૦૦          |
| ૨                                  | બાંધી મુદત થાપણો ઉપર      | ૩૨,૭૩,૮૩૭-૦૦          |
| ૩                                  | ગૃહલક્ષ્મી સર્ટીફિકેટ ઉપર | ૧,૩૩,૩૫,૩૩૧-૦૦        |
|                                    |                           | <b>૨,૪૫,૧૬,૦૭૨-૦૦</b> |

| ૩. ઇન્સ્યુરન્સ ખર્ચ |                                       |                    |
|---------------------|---------------------------------------|--------------------|
| ક્રમ                | વિગત                                  | તા. ૩૧-૦૩-૨૦૨૬     |
| ૧                   | બેન્કર્સ બ્લેન્કેટ ઇન્સ્યુ. પોલીસી    | ૧,૮૬,૪૪૦-૦૦        |
| ૨                   | ડી.આઈ.સી.જી.સી. ઇન્સ્યુ. પ્રિમી. ખર્ચ | ૭,૮૧,૪૬૮-૫૫        |
| ૩                   | પ્રિમીયમ (બિલ્ડિંગ, ફર્નીચર વગેરે)    | ૧૩,૫૧૫-૦૦          |
|                     |                                       | <b>૯,૮૧,૪૨૪-૫૫</b> |

| શેડ્યુઅલ-૧૬ ઓપરેટીંગ ચાર્જ                |                            |                       |
|-------------------------------------------|----------------------------|-----------------------|
| ૧. સ્ટાફ - પગાર - ભથ્થા - પ્રોવિઝન વિગેરે |                            |                       |
| ક્રમ                                      | વિગત                       | તા. ૩૧-૦૩-૨૦૨૬        |
| ૧                                         | સેલેરી                     | ૬૩,૩૪,૫૧૩-૦૦          |
| ૨                                         | મોંઘવારી ભથ્થુ             | ૨૩,૪૮,૭૭૭-૦૦          |
| ૩                                         | એચ.આર.એલાઉન્સ              | ૭૪,૧૦૦-૦૦             |
| ૪                                         | બેન્કસ કોન્ટ્રા. ગ્રેયુઈટી | ૧,૪૬,૨૮૧-૦૦           |
| ૫                                         | બેન્કસ કોન્ટ્રા. પી.એફ.    | ૮,૧૪,૮૭૮-૦૦           |
| ૬                                         | કેશ એલાઉન્સ                | ૨૩,૫૦૦-૦૦             |
| ૭                                         | ટાઈપીસ્ટ એલાઉન્સ           | ૪,૨૦૦-૦૦              |
| ૮                                         | વોર્શીંગ એલાઉન્સ           | ૧,૫૫૦-૦૦              |
| ૯                                         | સાયકલ એલાઉન્સ              | ૧,૫૫૦-૦૦              |
| ૧૦                                        | ક્લીયરીંગ એલાઉન્સ          | ૩૦,૦૦૦-૦૦             |
| ૧૧                                        | કેશ સ્ટીયીંગ એલાઉન્સ       | ૩,૩૦૦-૦૦              |
| ૧૨                                        | મેડીકલ એલાઉન્સ             | ૧,૨૬,૦૦૦-૦૦           |
| ૧૩                                        | કી - એલાઉન્સ               | ૫,૪૦૦-૦૦              |
| ૧૪                                        | કોમ્પ્યુટર એલાઉન્સ         | ૧૨,૧૦૦-૦૦             |
| ૧૫                                        | એડીશનલ ઇન્સ્ટીટ્યુટ        | ૨૬,૫૨,૭૭૪-૦૦          |
| ૧૬                                        | જનેરીટીંગ એલાઉન્સ          | ૪,૨૦૦-૦૦              |
| ૧૭                                        | ઈ.પી.એફ. ચાર્જ             | ૫૬,૬૬૮-૦૦             |
|                                           |                            | <b>૧,૨૭,૩૬,૮૦૧-૦૦</b> |

| ૨. રેન્ટ, ટેક્સ એન્ડ લાઇટીંગ |                      |                    |
|------------------------------|----------------------|--------------------|
| ક્રમ                         | વિગત                 | તા. ૩૧-૦૩-૨૦૨૬     |
| ૧                            | સી.જી.એસ.ટી. ખર્ચ    | ૩,૮૦૩-૦૦           |
| ૨                            | આઈ.જી.એસ.ટી. ખર્ચ    | ૦-૦૦               |
| ૩                            | એસ.જી.એસ.ટી. ખર્ચ    | ૩,૮૦૩-૦૦           |
| ૪                            | મ્યુનીસીપાલિટી ટેક્સ | ૩૮,૭૫૫-૦૦          |
| ૫                            | ઇલેક્ટ્રીસિટી ખર્ચ   | ૭૦,૬૮૮-૦૦          |
| ૬                            | ઇન્મકટેક્સ ખર્ચ      | ૮૪,૩૫૦-૦૦          |
| ૭                            | પ્રોફેશનલ ટેક્સ      | ૧,૦૦૦-૦૦           |
|                              |                      | <b>૨,૧૩,૪૦૯-૦૦</b> |

| ૪. પોસ્ટેજ, ટેલીગ્રામ, ટેલીફોન વિગેરે |         |                  |
|---------------------------------------|---------|------------------|
| ક્રમ                                  | વિગત    | તા. ૩૧-૦૩-૨૦૨૬   |
| ૧                                     | પોસ્ટેજ | ૧૬,૮૬૦-૮૦        |
| ૨                                     | ટેલીફોન | ૭૩,૮૪૮-૧૪        |
|                                       |         | <b>૯૦,૮૦૮-૯૪</b> |

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



## :: એનેક્ષર ::

| ૫. ઘસારા ખર્ચ |                                               |            |                |      |                       |             |
|---------------|-----------------------------------------------|------------|----------------|------|-----------------------|-------------|
| ક્રમ          | વિગત                                          | ઘસારાનો દર | તા. ૩૧-૦૩-૨૦૨૬ | ક્રમ | વિગત                  | ઘસારાનો દર  |
| ૧             | સી.સી.ટી.વી. કેમેરા અને રેકૉર્ડર - ઘસારા ખર્ચ | ૧૫ %       | ૭,૮૪૮-૦૦       | ૪    | મશીનરી - ઘસારા ખર્ચ   | ૧૫ %        |
| ૨             | ફર્નીચર અને ડેડ સ્ટોક - ઘસારા ખર્ચ            | ૧૦ %       | ૨૦,૨૫૫-૦૦      | ૫    | લોકર્સ - ઘસારા ખર્ચ   | ૧૦ %        |
| ૩             | કોમ્પ્યુટર - ઘસારા ખર્ચ                       | ૬૦ %       | ૨૪,૭૩૦-૦૦      | ૬    | બીલ્ડીંગ - ઘસારા ખર્ચ | ૧૦ %        |
|               |                                               |            |                |      |                       | ૨,૯૨,૦૨૦-૦૦ |

| ૬. રીપેર્સ એન્ડ મેઇન્ટેનન્સ |                       |                |      |                   |
|-----------------------------|-----------------------|----------------|------|-------------------|
| ક્રમ                        | વિગત                  | તા. ૩૧-૦૩-૨૦૨૬ | ક્રમ | તા. ૩૧-૦૩-૨૦૨૬    |
| ૧                           | રીપેર્સ ટુ પ્રિમાઈસીસ | ૧,૩૬,૮૩૭-૮૩    | ૨    | રીપેર્સ ટુ મશીનરી |
|                             |                       |                |      | ૩૦,૧૨૫-૦૦         |
|                             |                       |                |      | ૧,૬૭,૦૬૨-૮૩       |

| ૭. જાહેરાત ખર્ચ |                         |                |
|-----------------|-------------------------|----------------|
| ક્રમ            | વિગત                    | તા. ૩૧-૦૩-૨૦૨૬ |
| ૧               | જાહેરાત ખર્ચ            | ૪૭,૭૮૮-૦૦      |
| ૨               | જાહેરાત ખર્ચ (કેલેન્ડર) | ૫૫,૮૩૨-૦૦      |
|                 |                         | ૧,૦૩,૬૨૦-૦૦    |

| ૮. અન્ય ખર્ચ |                                     |                |      |                                  |
|--------------|-------------------------------------|----------------|------|----------------------------------|
| ક્રમ         | વિગત                                | તા. ૩૧-૦૩-૨૦૨૬ | ક્રમ | વિગત                             |
| ૧            | ઓપરેટીંગ/સર્વીસ ચાર્જ (એસ.જી.એલ.)   | ૧,૧૩૨-૫૦       | ૧૪   | કોમ્પ્યુટર સર્વીસ                |
| ૨            | ટ્રાવેલીંગ ખર્ચ                     | ૩૦,૮૧૨-૦૦      | ૧૫   | મશીનરી સર્વીસ ચાર્જ              |
| ૩            | કેડીટ ઈન્ફો. મેમ્બરશીપ ફી           | ૧૬,૮૦૦-૦૦      | ૧૬   | સ્ટાફ સરભરા ખર્ચ                 |
| ૪            | સબ-સ્ક્રીપ્શન ખર્ચ                  | ૨૮,૩૫૦-૦૦      | ૧૭   | ક્યુ.આર.કોડ ખર્ચ                 |
| ૫            | લોકર રેન્ટ ખર્ચ (એસ.બી.આઈ.)         | ૨,૩૬૦-૦૦       | ૧૮   | ડીએસસી ખર્ચ                      |
| ૬            | સરભરા ખર્ચ                          | ૪૮,૪૫૫-૦૦      | ૧૯   | લાઈટ ફીટીંગ                      |
| ૭            | વાર્ષિક જનરલ મીટીંગ ખર્ચ            | ૧૭,૭૮૫-૦૦      | ૨૦   | એસ.એમ.એસ. ખર્ચ                   |
| ૮            | ક્લીયરિંગ હાઉસ ચાર્જ                | ૧૪,૨૩૫-૧૦      | ૨૧   | સી.કે.વાય.સી. ખર્ચ               |
| ૯            | જનરેટીંગ ખર્ચ                       | ૩,૬૫૮-૦૦       | ૨૨   | બેંક વેબસાઈટ ખર્ચ                |
| ૧૦           | પરચુરણ ખર્ચ                         | ૪૮,૮૦૭-૭૨      | ૨૩   | સરસાઈ ખર્ચ                       |
| ૧૧           | લવાઈ ફી ખર્ચ                        | ૫૩,૮૦૨-૦૦      | ૨૪   | કેડીટ રીપોર્ટ ખર્ચ               |
| ૧૨           | સ્ટાફ ટ્રેનીંગ ખર્ચ                 | ૩,૫૪૦-૦૦       | ૨૫   | સ્ટેમ્પ ખર્ચ                     |
| ૧૩           | કમીશન એક્સચેન્જ અને બ્રોકરેટ (પેઈડ) | ૪૭-૭૮          | ૨૬   | લીગલ એન્ટીટી આઈડેન્ટીફિકેશન ખર્ચ |
|              |                                     |                |      | ૩,૩૦૪-૦૦                         |
|              |                                     |                |      | ૧૧,૦૫,૩૮૮-૦૦                     |

**કમલ સી. મહેતા એન્ડ કંપની.**  
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણિત અન્વેષક)  
FRN 104614W / M.NO.129801

**જે.એમ.ચૌહાણ**  
મેનેજર



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

તારીખ : ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું (૨૦૨૫-૨૬)

| તા. ૩૧-૦૩-૨૦૨૫  | મુકી તથા દેવુ                                                                                   | તા. ૩૧-૦૩-૨૦૨૬  |
|-----------------|-------------------------------------------------------------------------------------------------|-----------------|
|                 | (૧) શેર ભંડોળ                                                                                   |                 |
| ૨,૧૫,૦૦,૦૦૦-૦૦  | ક. અધિકૃત શેર ભંડોળ રૂ. ૧૦૦/-નો<br>એક એવા ૨,૧૫,૦૦૦/-                                            | ૨,૧૫,૦૦,૦૦૦-૦૦  |
| ૯૭,૮૬,૦૦૦-૦૦    | ખ. ભરપાઈ થયેલ શેર ભંડોળ<br>(અ) રૂ. ૧૦૦/-નો એક એવા ૯૭,૮૬૦/-<br>(બ) રૂ. ૧૦૦/-નો એક એવા ૧,૦૩,૪૪૫/- | ૧,૦૩,૪૪,૫૦૦-૦૦  |
|                 | (૨) રીઝર્વ તથા અન્ય ભંડોળ                                                                       |                 |
| ૭,૭૮,૧૨,૮૦૫-૫૮  | ક. સ્ટેચ્યુટરી રીઝર્વ                                                                           | ૮,૧૪,૪૭,૮૮૩-૧૮  |
| ૧,૩૮,૦૮,૭૬૫-૦૧  | ખ. બીલ્ડીંગ ફંડ                                                                                 | ૧,૪૮,૮૨,૬૧૫-૦૮  |
| ---             | ગ. ડીવીડન્ડ ઇક્વી. ફંડ                                                                          | ---             |
| ---             | ચ. સ્પે. (ઈન્કમેટેક્સ) રીઝર્વ                                                                   | ---             |
| ૧૦,૮૭,૨૩,૮૩૧-૪૩ | છ. બેંક એડ્ડ ડાઉટફુલ ડેબ્ટ રીઝર્વ                                                               | ૧૦,૮૮,૩૬,૮૩૧-૪૩ |
|                 | જ. રોકાણો ધસારા ફંડ                                                                             |                 |
|                 | ઝ. અન્ય ભંડોળ                                                                                   |                 |
| ૮,૮૦,૦૦૦-૦૦     | (૧) સ્ટન્ડર્ડ એસેટ ફંડ (એન.પી.એ.)                                                               | ૮,૮૦,૦૦૦-૦૦     |
| ૪,૨૭૮-૬૪        | (૨) એમ્પ્લોઈ કલ્યાણ ફંડ                                                                         | ૧૮,૬૬૪-૬૫       |
| ૩૭,૧૪,૭૮૪-૮૩    | (૩) બેન્કીંગ ડેવલોપમેન્ટ ફંડ                                                                    | ૩૮,૮૩,૨૫૭-૩૫    |
| ૩૪,૭૪,૩૦૭-૫૭    | (૪) સાર્વજનિક હેતુ ફંડ                                                                          | ૩૭,૪૨,૭૭૦-૦૮    |
| ૩૮,૩૫,૧૭૬-૪૮    | (૫) સભાસદ કલ્યાણ ફંડ                                                                            | ૪૩,૬૦,૫૬૪-૦૫    |
| ૨,૨૧,૮૨,૮૦૦-૩૬  | (૬) રોકાણોમાં થયેલ વધ ઘટ ફંડ                                                                    | ૨,૦૬,૭૧,૫૦૩-૦૮  |
| ---             | (૭) સભાસદ ગ્રીફટ ફંડ                                                                            | ---             |
| ---             | (૮) સમકાલીન ફંડ                                                                                 | ---             |
| ---             | (૯) ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીએશન ફંડ-જીઓઆઈ                                                           | ૭૫,૩૭,૦૦૦-૦૦    |
| ૧૫,૦૦,૦૦૦-૦૦    | (૧૦) સાયબર સિક્યુરીટી ફંડ                                                                       | ૧૫,૦૦,૦૦૦-૦૦    |
| ૩૫,૦૦,૦૦૦-૦૦    | (૧૧) બીડીડીઆર ફંડ આઈટી(૩૬)(૧)(૭એ)                                                               | ૩૫,૦૦,૦૦૦-૦૦    |
| ૧૪,૭૦,૭૪૭-૪૭    | (૧૨) બીડીડીઆર વર્ષ : ૨૦૨૪                                                                       | ૩૦,૪૮,૩૭૭-૮૨    |
|                 |                                                                                                 | ૨૫,૪૬,૧૧,૫૬૬-૭૪ |
|                 | (૩) થાપણો અને અન્ય ખાતાઓ :                                                                      |                 |
|                 | ક. ફીક્સ ડીપોઝીટ                                                                                |                 |
| ૪,૮૮,૭૮,૩૫૨-૦૦  | (૧) ફીક્સ ડીપોઝીટ                                                                               | ૪,૭૮,૮૮,૪૨૪-૦૦  |
| ૧૮,૪૧,૮૮,૫૫૨-૦૦ | (૨) ગૃહ લક્ષ્મી સર્ટી                                                                           | ૨૧,૩૭,૭૬,૭૫૦-૦૦ |
| ૨૫,૭૧,૫૭,૭૮૮-૧૧ | ખ. સેવીંગ બેન્ક થાપણ (એનેક્સર - I)                                                              | ૨૫,૮૬,૬૭,૧૪૩-૧૪ |
| ૭,૪૮,૩૪,૩૦૧-૮૭  | ગ. કરંટ થાપણો (એનેક્સર - II)                                                                    | ૫,૬૪,૪૧,૪૨૦-૫૧  |
|                 | દેના બેંક - બોટાદ એફ.ડી.ટી.ઓ.ડી. એકા.                                                           | ૫૭,૭૮,૭૪,૭૩૭-૬૫ |
|                 |                                                                                                 | ---             |
|                 | (૪) કોન્ટ્રા :                                                                                  |                 |
| ---             | ક. વસુલ થવા આવેલ બીલો                                                                           | ---             |
| ---             | ખ. વસુલ થવા મોકલેલ અન-ક્લેઈમ ડીપોઝીટ<br>(ડી.ઈ.એ.એફ. ૧૪ સ્કીમ RBI)                               | ---             |

૮૨,૬૯,૬૩,૭૦૨-૪૭ સરવાળો આગળ લઈ ગયા...

૮૪,૨૮,૩૦,૮૦૪-૩૯

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



તારીખ : ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું (૨૦૨૫-૨૬)

| તા. ૩૧-૦૩-૨૦૨૫  | મિલ્કત તથા લેણું                                    | તા. ૩૧-૦૩-૨૦૨૬  |
|-----------------|-----------------------------------------------------|-----------------|
| ૭૩,૧૧,૪૨૫-૪૨    | (૧) રોકડ :                                          | ૯૮,૦૦,૧૨૮-૧૭    |
|                 | (૨) બેંકોમાં સિલક :                                 |                 |
| ૭,૦૫,૩૩,૬૩૦-૦૩  | ક. કરંટ ડિપોઝીટ (એનેક્ષર - III)                     | ૪,૫૬,૫૫,૦૮૬-૦૪  |
| ૫,૮૨૪-૩૮        | ખ. સેવીંગ બેન્ક થાપણ                                | ૫,૮૨૪-૩૮        |
| ૨,૫૪,૦૦,૦૦૦-૦૦  | ગ. ફીક્સ ડિપોઝીટ (એનેક્ષર - IV)                     | ૫,૦૦,૦૦,૦૦૦-૦૦  |
|                 |                                                     | ૯,૫૬,૫૧,૦૧૦-૪૩  |
| ૫૩,૭૬,૫૦,૧૮૧-૦૦ | (૩) રોકાણો : (એનેક્ષર - V)                          |                 |
|                 | ક. કેન્દ્રીય અને રાજ્ય ગવર્નમેન્ટ સીક્યુરીટી રોકાણો |                 |
|                 | (૧) અવેલેબલ ફોર સેલ (એ.એફ.એસ.)                      |                 |
|                 | ૧. ફેસ વેલ્યુ - રૂ. ૪૨,૮૪,૩૦,૦૦૦-૦૦                 |                 |
|                 | ૨. બુક વેલ્યુ - રૂ. ૪૧,૧૪,૬૦,૨૩૦-૦૦                 |                 |
|                 | ૩. માર્કેટ વેલ્યુ - રૂ. ૪૧,૩૮,૨૩,૮૮૩-૦૦             |                 |
|                 | (૨) હેલ્ડ ટુ મેચ્યુરીટી (એચ.ટી.એમ.)                 |                 |
|                 | ૧. ફેસ વેલ્યુ - રૂ. ૧૨,૧૬,૮૦,૦૦૦-૦૦                 |                 |
|                 | ૨. બુક વેલ્યુ - રૂ. ૧૧,૮૦,૨૮,૭૧૩-૦૦                 | ૫૪,૦૪,૮૮,૮૪૩-૦૦ |
| ૨,૧૧,૦૦૦-૦૦     | ખ. અન્ય કો.ઓ.બેન્ક લી.ના શેરો                       | ૨,૧૧,૦૦૦-૦૦     |
|                 |                                                     | ૫૪,૦૬,૯૯,૯૪૩-૦૦ |
| ૧૮,૦૬,૬૮,૩૮૭-૫૪ | (૪) ધિરાણો (એનેક્ષર - VI)                           |                 |
|                 | અ. (૧) ટુંકી મુદતના ધિરાણો તે પૈકી                  | ૧૮,૭૬,૨૭,૧૨૫-૮૭ |
|                 | (૨) મુદત વિતી ધિરાણ                                 |                 |
|                 | (૬,૪૩,૭૨,૮૪૦-૩૫)                                    |                 |
| ૧,૧૮,૬૭૧-૦૦     | બ. (૧) મધ્યમ મુદતના ધિરાણો તે પૈકી                  | ૧,૦૩,૪૦૦-૦૦     |
|                 | (૨) મુદત વિતી ધિરાણ                                 |                 |
|                 | (૧,૦૩,૪૦૦-૦૦)                                       |                 |
| ૧,૬૪,૮૫,૫૮૬-૧૦  | ક. (૧) લાંબી મુદતના ધિરાણો તે પૈકી                  | ૧,૭૮,૫૨,૮૫૫-૧૦  |
|                 | (૨) મુદત વિતી ધિરાણ                                 |                 |
|                 | (૧૦,૧૨,૨૩૪-૧૦)                                      |                 |
|                 |                                                     | ૨૦,૫૫,૮૩,૪૮૧-૦૭ |
| ૮૮,૬૧,૦૪૭-૦૦    | (૫) મળવાપાત્ર વ્યાજ (રોકાણો ઉપર)                    | ૮૩,૦૫,૧૪૨-૦૦    |
|                 | (૬) કોન્ટ્રા :                                      |                 |
| ---             | ક. વસુલ થવા આવેલ બીલો.                              | ---             |
| ---             | ખ. ડી.ઈ.એ.એફ-૨૦૧૪ સ્કીમ                             | ---             |
|                 | (વીથ આર.બી.આઈ.)                                     |                 |
| ૨૧,૧૧,૦૧,૪૭૫-૭૮ | ગ. એન.પી.એ. ઇન્ટરેસ્ટ રીસીવીબેબલ (કોન્ટ્રા)         | ૨૧,૮૬,૬૦,૫૫૨-૨૬ |
|                 |                                                     | ૨૧,૮૬,૬૦,૫૫૨-૨૬ |

૧,૦૫,૮૪,૪૬,૩૩૮-૨૭ સરવાળો આગળ લઈ ગયા...

૧,૦૭,૮૭,૧૦,૨૫૬-૯૩



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

તારીખ : ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું (૨૦૨૫-૨૬)

| તા. ૩૧-૦૩-૨૦૨૫    | મુકી તથા દેવુ                                      | તા. ૩૧-૦૩-૨૦૨૬    |
|-------------------|----------------------------------------------------|-------------------|
| ૮૨,૬૬,૬૩,૭૦૨-૪૭   | સરવાળો આગળ લાવ્યા...                               | ૮૪,૨૮,૩૦,૮૦૪-૩૬   |
| ૨૧,૧૧,૦૧,૪૭૫-૭૮   | ગ. ઓવરડ્યુ એન.પી.એ.ઈન્ટરેસ્ટ રીઝર્વ (કોન્ટ્રી)     | ૨૧,૮૬,૬૦,૫૫૨-૨૬   |
| ૮,૭૧,૬૧૪-૦૦       | (પ) થાપણો ઉપર ચુકવવા પાત્ર વ્યાજ                   | ૮,૧૪,૧૮૧-૦૦       |
| ૭૨,૮૩,૧૩૦-૦૦      | ક. ઈન્ટરેસ્ટ પેએબલ એફ.ડી.                          | ૭૮,૦૧,૩૦૧-૦૦      |
| ૨૮૫-૦૮            | ખ. ઈન્ટરેસ્ટ પેએબલ જી.સી.                          | ૨૮૫-૦૮            |
| ૧,૦૧,૨૮૨-૦૦       | ગ. ઈન્ટરેસ્ટ પેએબલ કરંટ                            | ૨૮૫-૦૮            |
| ૮,૫૮,૮૮૫-૦૦       | ઘ. ઈન્ટરેસ્ટ પેએબલ મેચ્યુ. એફ.ડી.                  | ૮૦,૭૬૨-૦૦         |
| ૬,૦૭,૮૨૪-૫૩       | ચ. ઈન્ટરેસ્ટ પેએબલ મેચ્યુ. જી.સી.                  | ૬,૨૧,૩૧૮-૦૦       |
| ૪,૭૮૦-૬૦          | છ. ઈન્ટરેસ્ટ પેએબલ મેચ્યુ. ડિપોઝીટ                 | ૬,૧૨,૭૦૫-૧૩       |
|                   | જ. ઈન્ટરેસ્ટ પેએબલ મેચ્યુ. એફડી એસબી ઈન્ટ.         | ૧૪,૫૧૦-૧૦         |
|                   | (ફ) અન્ય જવાબદારીઓ :                               |                   |
| ૩,૨૫,૮૭૦-૭૦       | ક. બીલ્સ પેએબલ                                     | ૧,૨૨,૧૫૬-૨૩       |
| ૧,૨૭,૪૬૭-૦૦       | ખ. અનકલે ડીવીડન્ડ ૨૧-૨૨                            | ---               |
| ૧,૨૮,૬૫૫-૦૦       | ગ. અનકલે ડીવીડન્ડ ૨૨-૨૩                            | ૧,૨૮,૬૫૫-૦૦       |
| ૭૧,૪૭૮-૦૦         | ઘ. અનકલે ડીવીડન્ડ ૨૩-૨૪                            | ૬૬,૮૬૧-૦૦         |
| ---               | ચ. અનકલે ડીવીડન્ડ ૨૪-૨૫                            | ૧,૩૮,૫૧૮-૦૦       |
| ૧૪,૦૭૨-૩૩         | છ. એસજીએસટી પેએબલ                                  | ---               |
| ૧૪,૦૭૨-૩૩         | જ. સીજીએસટી પેએબલ                                  | ૧૪,૫૧૦-૧૦         |
| ---               | ઝ. આઈજીએસટી પેએબલ                                  | ---               |
| ૫૦-૦૦             | ટ. સન્ડ્રી ક્રેડીટર્સ                              | ૫૦-૦૦             |
| ૧,૨૭,૦૨૮-૦૮       | ઠ. બ્લોકડ એકાઉન્ટ જુના આઉટ સ્ટેન્ડીંગ કે. એન્ટ્રી. | ૧,૦૧,૪૮૪-૦૦       |
| ---               | ડ. પ્રોફેશનલ ટેક્ષ ડીડક્શન                         | ૨૦૦-૦૦            |
| ૮૭,૧૦૦-૦૦         | ઢ. શેર રીઝર્વ                                      | ---               |
| ૩૬,૦૨,૧૮૦-૦૦      | ણ. પ્રોવીઝન ફોર ઈન્કમટેક્ષ - ચાલુ સાલ              | ૩૪,૦૧,૬૩૬-૦૦      |
| ---               | ત. લોકર રેન્ટ પેએબલ                                | ૧૮,૧૪૦-૦૦         |
| ---               | થ. સ્ટેશનરી પેએબલ                                  | ---               |
| ---               | દ. ઈલેક્શન ડીપોઝીટ                                 | ---               |
| ---               | ધ. ટી.ડી.એસ. ફોમ એફ.ડી.ઈન્ટ./બીલ્સ                 | ---               |
|                   | (૭) નફો - નુકશાન ખાતું                             |                   |
| ---               | ગઈ સાલનો નફો                                       | ૧,૦૫,૨૪,૨૦૨-૩૫    |
| ---               | બાદ : ફાળવણી                                       | ૧,૦૫,૨૪,૨૦૨-૩૫    |
| ---               | ગઈ સાલની બાકી                                      | ---               |
| ૧,૦૫,૨૪,૨૦૨-૩૫    | જ ઉમેરો : ચાલુ સાલનો નફો                           |                   |
| ૩૫,૦૦,૦૦૦-૦૦      | ૧. ચોખ્ખો નફો                                      | ૧,૦૬,૨૭,૮૬૬-૪૮    |
|                   | ૨. એક્સેસ રીઝર્વ / પ્રોવીઝન બીલોવ લાઈન             | ---               |
| ૧,૦૬,૬૪,૨૬,૨૬૬-૨૭ | કુલ સરવાળો                                         | ૧,૦૮,૫૧,૬૬,૬૦૬-૭૬ |
|                   | કોન્ટ્રા :- અનકલેધમ ડીપોઝીટ પેએબલ                  | ૧,૩૫,૨૦,૩૮૬-૬૭    |

અમદાવાદ

તા. ૧૨-૦૫-૨૦૨૬

કમલ સી. મહેતા એન્ડ કંપની.  
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણિત અન્વેષક)  
FRN 104614W / M.NO.129801  
UDIN NO.26129801KTBIZA2454

જે.એમ.ચૌહાણ  
મેનેજર

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



તારીખ : ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું (૨૦૨૫-૨૬)

| તા. ૩૧-૦૩-૨૦૨૫    | મિલ્કત તથા લેણું                     | તા. ૩૧-૦૩-૨૦૨૬    |
|-------------------|--------------------------------------|-------------------|
| ૧,૦૫,૮૪,૪૯,૩૩૮-૨૭ | સરવાળો આગળ લાવ્યા...                 | ૧,૦૭,૮૭,૧૦,૨૫૬-૯૩ |
| ૧૧,૮૭,૭૬૧-૦૦      | (૭) મકાન બાંધકામ : (એનેક્સર - VII)   | ૧૧,૮૨,૮૬૭-૦૦      |
| ૧૭,૧૮,૫૦૮-૩૨      | (૮) કાયમી મિલ્કતો : (એનેક્સર - VIII) | ૧૫,૭૬,૫૩૪-૩૧      |
|                   | (૯) ટેક્ષ એન્ડ ડિપોઝીટ :             |                   |
| ૭,૮૧૭-૩૦          | ક. સીકેવાયસી ડીપોઝીટ                 | ૭,૮૧૨-૮૦          |
| ---               | ખ. ઇન્ટ. રીસી. ડીફ. એક્સગ્રેસીયા     | ---               |
| ૧,૬૭,૦૪૩-૦૦       | ગ. એસજીએસટી રીસીવેબલ                 | ૧,૩૪,૮૮૨-૦૦       |
| ૧,૮૩,૮૩૧-૦૦       | ઘ. સીજીએસટી રીસીવેબલ                 | ૧,૬૩,૫૬૮-૦૦       |
| ---               | ચ. આઈજીએસટી રીસીવેબલ                 | ---               |
| ૧,૦૧૨-૦૦          | છ. સરસાઈ ડીપોઝીટ                     | ૨,૦૪૫-૦૦          |
| ૦-૦૦              | જ. કમીશન રીસીવેબલ પીજીવીસીએલ         | ૦-૦૦              |
| ૩,૭૦,૮૨૨-૨૩       | ઝ. એક્યુરેડ ઇન્ટ. પેઈડ ઓન GOI        | ૨,૭૫,૨૫૦-૦૦       |
| ૩૫,૮૫,૦૦૦-૦૦      | ટ. એડવાન્સ ટેક્ષ                     | ૩૪,૦૦,૦૦૦-૦૦      |
| ૭,૧૮૦-૦૦          | ઠ. ટી.ડી.એસ. રીસીવેબલ                | ૧,૬૩૨-૦૦          |
| ૧,૪૮૫-૧૫          | ડ. લાયબ્રેરી                         | ૧,૪૮૫-૧૫          |
| ---               | ઢ. સ્ટેશનરી સ્ટોક                    | ---               |
| ૮,૨૬૦-૦૦          | ણ. સ્ટેમ્પ સ્ટોક                     | ૬૭૦-૦૦            |
| ૨,૦૪,૭૫૫-૦૦       | ત. સન્ડ્રી ડેબટર્સ                   | ૨,૦૭,૦૨૦-૬૦       |
| ૨,૩૭૨-૦૦          | થ. ટેલીફોન ડીપો.                     | ૨,૩૭૨-૦૦          |
| ૫,૦૦,૦૦૦-૦૦       | દ. પી.જી.વી.સી.એલ. ડીપો.             | ૫,૦૦,૦૦૦-૦૦       |
| ---               | ધ. કલેઈમ રીસીવ ફોમ આર.બી.આઈ.         | ---               |
| ---               | ન. ઇન્ટ. રીસી. ડી.ઈ.એ.એફ. - ૧૪       | ---               |
|                   |                                      | ૪૬,૯૬,૮૪૮-૫૫      |
| ૧,૦૬,૬૪,૨૬,૨૯૬-૨૭ | કુલ સરવાળો                           | ૧,૦૮,૬૧,૬૬,૬૦૬-૭૯ |

કોન્ટ્રા :-

DEAF ૨૦૧૪ સ્કીમ આર.બી.આઈ.

૧,૩૫,૨૦,૩૮૯-૯૭

શ્રી ધર્મેન્દ્રકુમાર પી. વડોદરીયા  
ચેરમેનશ્રી

શ્રી ભુપતરાય ડી. શાહ  
વાઈસ ચેરમેનશ્રી

:: બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ::

શ્રી અનિલભાઈ કે. શેઠ

શ્રી પ્રતિકભાઈ જે. વડોદરીયા

શ્રી હસમુખભાઈ એસ. શાહ

શ્રી ભરતભાઈ એન. ગોપાણી

શ્રી સુધીરભાઈ એચ. વાઘેલા

શ્રી અલ્કેશભાઈ ટી. શેઠ

શ્રી દિનેશભાઈ એસ. શાહ

શ્રીમતી ધ્વનિબેન ડી. વડોદરીયા

શ્રી છાયાબેન કે. ચીકાણી

શ્રી નયીકેતભાઈ જી. વડોદરીયા

શ્રી ભાવેશભાઈ બી. શેઠ



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## :: એનેક્ષર ::

| એનેક્ષર - I : બચત ખાતાની થાપણો |                             |                        |
|--------------------------------|-----------------------------|------------------------|
| ક્રમ                           | વિગત                        | તા. 31-03-2025         |
| ૧                              | બચત ખાતાની થાપણો            | ૨૫,૮૬,૬૧,૨૧૮-૭૫        |
| ૨                              | સ્ટાફ પ્રોવીડન્ટ ફંડ સેવિંગ | ૫,૮૨૪-૩૮               |
|                                |                             | <b>૨૫,૮૬,૬૭,૧૪૩-૧૪</b> |

| એનેક્ષર - II : ચાલુ ખાતાની થાપણો |                                 |                       |
|----------------------------------|---------------------------------|-----------------------|
| ક્રમ                             | વિગત                            | તા. 31-03-2025        |
| ૧                                | ચાલુ ખાતુ                       | ૪,૦૮,૩૦,૪૮૦-૨૨        |
| ૨                                | હાઇપોથેકેશન કેડીટ બેલેન્સ       | ૭,૦૨,૧૩૪-૮૫           |
| ૩                                | પ્લેઝ કેડીટ બેલેન્સ             | ૧૮,૬૭૧-૬૫             |
| ૪                                | ટી.ઓ.ડી. એફ. ટી. કેડીટ          | ૨,૮૬,૪૫૫-૭૮           |
| ૫                                | ક્લીન ઓવર ડ્રાફ્ટ કેડીટ બેલેન્સ | ૩,૪૫,૮૨૧-૨૪           |
| ૬                                | ન્યુ હાઇપોથેકેશન કેડીટ બેલેન્સ  | ૧,૧૮,૫૧૮-૬૮           |
| ૭                                | એસ.ઓ.ડી. કેડીટ બેલેન્સ          | ૫૩,૪૧,૪૪૮-૦૮          |
| ૮                                | મેયોર્ડ ફીક્સ ડીપોઝીટ           | ૨૮,૬૦,૫૭૭-૦૦          |
| ૯                                | મેયોર્ડ ગૃહ લક્ષ્મી સર્ટીફિકેટ  | ૫૭,૨૬,૩૦૨-૦૦          |
|                                  |                                 | <b>૫,૬૪,૪૧,૪૨૦-૫૧</b> |

| એનેક્ષર - III : રોકડ તથા બેંકોમાં સિલક થાપણો |                                                               |                       |
|----------------------------------------------|---------------------------------------------------------------|-----------------------|
| ક્રમ                                         | વિગત                                                          | તા. 31-03-2025        |
| ૧                                            | આઈ.ડી.બી.આઈ. બેન્ક ચાલુ ખાતુ - બોટાદ બ્રાન્ચ                  | ૧,૧૪,૫૦,૬૧૮-૩૨        |
| ૨                                            | બી.ડી.સી.બેન્ક ચાલુ ખાતુ - બોટાદ બ્રાન્ચ (મેઈન બ્રાન્ચ)       | ૨૪,૩૦૮-૬૩             |
| ૩                                            | જી.એસ.સી. બેન્ક ચાલુ ખાતુ - અમદાવાદ બ્રાન્ચ                   | ૭૩,૮૨,૮૮૧-૮૦          |
| ૪                                            | એસ.બી.આઈ. ચાલુ ખાતુ - બોટાદ બ્રાન્ચ                           | ૬૩,૭૮,૧૦૨-૧૪          |
| ૫                                            | જી.એસ.સી. બેન્ક આર.ટી.જી.એસ. / એનઈએફટી ખાતુ - અમદાવાદ બ્રાન્ચ | ૧,૪૭,૭૪,૨૧૪-૮૮        |
| ૬                                            | જી.એસ.સી. બેન્ક સીએ / એસ.જી.એલ.ખાતુ - અમદાવાદ બ્રાન્ચ         | ૪૫,૮૮૬-૦૩             |
| ૭                                            | આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક - બોટાદ બ્રાન્ચ                         | ૨૫,૦૮૬-૦૦             |
| ૮                                            | જી.એસ.સી. બેંક કરંટ એન.એ.સી.એચ.                               | ૬,૦૮,૨૨૫-૧૩           |
| ૯                                            | આઈ.ડી.એફ.સી. ફસ્ટ બેંક કરંટ ખાતુ - બોટાદ બ્રાન્ચ              | ૪૮,૫૪,૫૪૧-૦૦          |
|                                              |                                                               | <b>૪,૫૬,૫૫,૦૮૬-૦૪</b> |

| એનેક્ષર - IV : જુદા જુદા પ્રકારની બાંધી મુદતની થાપણો |                                                    |                       |
|------------------------------------------------------|----------------------------------------------------|-----------------------|
| ક્રમ                                                 | વિગત                                               | તા. 31-03-2025        |
| ૧                                                    | ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક લી. - અમદાવાદ              | ૫૦,૦૦,૦૦૦-૦૦          |
| ૨                                                    | ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક લી. - અમદાવાદ (એમ.એ.સ્કીમ) | ૫૦,૦૦,૦૦૦-૦૦          |
| ૩                                                    | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા - બોટાદ                      | ૧,૦૦,૦૦,૦૦૦-૦૦        |
| ૪                                                    | આઈ.ડી.બી.આઈ. બેંક - બોટાદ                          | ૧,૫૦,૦૦,૦૦૦-૦૦        |
| ૫                                                    | આઈ.સી.આઈ.સી.આઈ. બેંક - બોટાદ                       | ૫૦,૦૦,૦૦૦-૦૦          |
| ૬                                                    | આઈ.ડી.એફ.સી. બેંક - બોટાદ                          | ૧,૦૦,૦૦,૦૦૦-૦૦        |
|                                                      |                                                    | <b>૫,૦૦,૦૦,૦૦૦-૦૦</b> |

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ



## એનેક્સર - V : જી.ઓ.આઇ. સીક્યુરીટીઝમાં રોકાણો

| No.          | Particulars of Investment                                                           | Face Value             | Purchase Amount                              | Book Value as on 31-03-2026                 |
|--------------|-------------------------------------------------------------------------------------|------------------------|----------------------------------------------|---------------------------------------------|
| <b>A (i)</b> | <b>In Central &amp; State Govt. Security (At Book Value) Held to Maturity (HTM)</b> |                        |                                              |                                             |
| 1            | 6.13 % GOI 2028                                                                     | 2,00,00,000-00         | 2,00,43,128-00                               | 2,00,43,128-00                              |
| 2            | 6.68 % GOI 2031                                                                     | 41,90,000-00           | 41,35,530-00                                 | 41,35,530-00                                |
| 3            | 8.26 % GOI 2027                                                                     | 2,00,00,000-00         | 2,01,61,000-00                               | 2,01,61,000-00                              |
| 4            | 8.26 % GOI 2027                                                                     | 2,00,00,000-00         | 2,00,87,000-00                               | 2,00,87,000-00                              |
| 5            | 8.26 % GOI 2027                                                                     | 25,00,000-00           | 25,02,681-00                                 | 25,02,681-00                                |
| 6            | 8.26 % GOI 2027                                                                     | 50,00,000-00           | 50,04,374-00                                 | 50,04,374-00                                |
| 7            | 6.91 % MHSDL 2033                                                                   | 5,00,00,000-00         | 4,70,95,000-00                               | 4,70,95,000-00                              |
|              | <b>Total (i)</b>                                                                    | <b>12,16,90,000-00</b> | <b>11,90,28,713-00</b>                       | <b>11,90,28,713-00</b>                      |
| <b>(ii)</b>  | <b>Available for Sale (AFS)</b>                                                     |                        |                                              |                                             |
| 1            | 6.19% GOI 2034                                                                      | 1,00,00,000-00         | 98,32,000-00<br>(Market Value on 31.03.26)   | 98,32,000-00<br>(94,63,640-00)              |
| 2            | 6.62 % GOI 2051                                                                     | 1,00,00,000-00         | 97,95,000-00<br>(Market Value on 31.03.26)   | 97,95,000-00<br>(87,99,970-00)              |
| 3            | 6.64 % GOI 2035                                                                     | 1,00,00,000-00         | 98,85,000-00<br>(Market Value on 31.03.26)   | 98,85,000-00<br>(87,61,900-00)              |
| 4            | 6.67 % GOI 2035                                                                     | 1,00,00,000-00         | 96,70,000-00<br>(Market Value on 31.03.26)   | 96,70,000-00<br>(97,25,830-00)              |
| 5            | 6.67 % GOI 2035                                                                     | 1,00,00,000-00         | 98,98,000-00<br>(Market Value on 31.03.26)   | 98,98,000-00<br>(97,25,830-00)              |
| 6            | 6.67 % GOI 2050                                                                     | 3,50,00,000-00         | 3,39,11,500-00<br>(Market Value on 31.03.26) | 3,39,11,500-00<br>(3,08,48,230-00)          |
| 7            | 6.67 % GOI 2050                                                                     | 50,00,000-00           | 49,27,500-00<br>(Market Value on 31.03.26)   | 49,27,500-00<br>(44,06,890-00)              |
| 8            | 6.67 % GOI 2050                                                                     | 1,00,00,000-00         | 94,35,000-00<br>(Market Value on 31.03.26)   | 94,35,000-00<br>(88,13,780-00)              |
| 9            | 6.67 % GOI 2050                                                                     | 1,00,00,000-00         | 99,40,000-00<br>(Market Value on 31.03.26)   | 99,40,000-00<br>(88,13,780-00)              |
| 10           | 6.67 % GOI 2050                                                                     | 1,00,00,000-00         | 99,40,000-00<br>(Market Value on 31.03.26)   | 99,40,000-00<br>(88,13,780-00)              |
| 11           | 6.83 % GOI 2039                                                                     | 1,00,00,000-00         | 96,90,000-00<br>(Market Value on 31.03.26)   | 96,90,000-00<br>(96,43,520-00)              |
| 12           | 6.83 % GOI 2039                                                                     | 1,00,00,000-00         | 99,95,000-00<br>(Market Value on 31.03.26)   | 99,95,000-00<br>(96,43,520-00)              |
| 13           | 6.99 % GOI 2051                                                                     | 50,00,000-00           | 49,40,000-00<br>(Market Value on 31.03.26)   | 49,40,000-00<br>(45,85,015-00)              |
| 14           | 6.99 % GOI 2051                                                                     | 1,00,00,000-00         | 99,81,000-00<br>(Market Value on 31.03.26)   | 99,81,000-00<br>(91,70,030-00)              |
| 15           | 7.16 % GOI 2050                                                                     | 50,00,000-00           | 49,52,500-00<br>(Market Value on 31.03.26)   | 49,52,500-00<br>(46,76,405-00)              |
| 16           | 7.25 % GOI 2063                                                                     | 3,00,00,000-00         | 2,97,18,000-00<br>(Market Value on 31.03.26) | 2,97,18,000-00<br>(2,82,50,070-00)          |
| 17           | 7.26 % GOI 2032                                                                     | 50,00,000-00           | 49,54,500-00<br>(Market Value on 31.03.26)   | 49,54,500-00<br>(50,50,130-00)              |
| 18           | 7.34% GOI 2064                                                                      | 1,00,00,000-00         | 98,95,000-00<br>(Market Value on 31.03.26)   | 98,95,000-00<br>(94,82,530-00)              |
| 19           | 7.34 % GOI 2064                                                                     | 1,00,00,000-00         | 99,15,000-00<br>(Market Value on 31.03.26)   | 99,15,000-00<br>(94,82,530-00)              |
| 20           | 7.40 % GOI 2035                                                                     | 50,00,000-00           | 46,62,500-00<br>(Market Value on 31.03.26)   | 46,62,500-00<br>(51,17,855-00)              |
| 21           | 7.40 % GOI 2035                                                                     | 50,00,000-00           | 49,82,500-00<br>(Market Value on 31.03.26)   | 49,82,500-00<br>(51,17,855-00)              |
| 22           | 7.40 % GOI 2035                                                                     | 50,00,000-00           | 48,80,000-00<br>(Market Value on 31.03.26)   | 48,80,000-00<br>(51,17,855-00)              |
| 23           | 7.88 % GOI 2030                                                                     | 1,00,00,000-00         | 99,00,000-00<br>(Market Value on 31.03.26)   | 99,00,000-00<br>(1,03,81,090-00)            |
| 24           | 8.26 % GOI 2027                                                                     | 25,00,000-00           | 25,10,385-00<br>(Market Value on 31.03.26)   | 25,10,385-00<br>(25,74,562-00)              |
| 25           | 8.28 % GOI 2027                                                                     | 1,00,00,000-00         | 1,03,55,000-00<br>(Market Value on 31.03.26) | 1,03,55,000-00<br>(1,03,81,320-00)          |
| 26           | 8.28 % GOI 2032                                                                     | 1,00,00,000-00         | 98,90,000-00<br>(Market Value on 31.03.26)   | 98,90,000-00<br>(1,05,66,620-00)            |
| 27           | 6.57 % TNSDL 2031                                                                   | 50,00,000-00           | 49,47,500-00<br>(Market Value on 31.03.26)   | 49,47,500-00<br>(48,10,425-00)              |
| 28           | 6.91 % RJDL 2031                                                                    | 1,00,00,000-00         | 97,30,000-00<br>(Market Value on 31.03.26)   | 97,30,000-00<br>(97,26,460-00)              |
| 29           | 7.07 % TNSDL 2026                                                                   | 5,00,00,000-00         | 4,74,88,750-00<br>(Market Value on 31.03.26) | 4,74,88,750-00<br>(5,03,98,350-00)          |
| 30           | 7.07 % TNSDL 2026                                                                   | 1,00,00,000-00         | 1,00,50,000-00<br>(Market Value on 31.03.26) | 1,00,50,000-00<br>(1,00,79,670-00)          |
| 31           | 7.07 % KASDL 2026                                                                   | 5,00,00,000-00         | 5,02,50,000-00<br>(Market Value on 31.03.26) | 5,02,50,000-00<br>(5,03,98,350-00)          |
| 32           | 7.14 % KASDL 2029                                                                   | 50,00,000-00           | 49,97,500-00<br>(Market Value on 31.03.26)   | 49,97,500-00<br>(49,68,400-00)              |
| 33           | 7.16 % KASDL 2030                                                                   | 1,00,00,000-00         | 1,00,00,000-00<br>(Market Value on 31.03.26) | 1,00,00,000-00<br>(98,95,170-00)            |
| 34           | 7.17 % PNSDL 2030                                                                   | 50,00,000-00           | 49,97,500-00<br>(Market Value on 31.03.26)   | 49,97,500-00<br>(49,49,195-00)              |
| 35           | 7.19 % TNSDL 2042                                                                   | 59,30,000-00           | 58,38,085-00<br>(Market Value on 31.03.26)   | 58,38,085-00<br>(55,67,825-25)              |
| 36           | 91 DTB MATURING ON 11/06/2026                                                       | 1,50,00,000-00         | 1,48,05,510-00<br>(Market Value on 31.03.26) | 1,48,05,510-00<br>(1,48,05,510-00)          |
|              | <b>Total (ii)</b>                                                                   | <b>42,84,30,000-00</b> | <b>42,14,60,230-00</b>                       | <b>42,14,60,230-00</b><br>(41,39,23,893-00) |
|              | <b>Total (A) (i+ii)</b>                                                             | <b>55,01,20,000-00</b> |                                              | <b>54,04,88,943-00</b>                      |



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## એનેક્સર - V : જી.ઓ.આઇ. સીક્યુરીટીઝમાં રોકાણો

| No. | Particulars of Investment               | Face Value  | Purchase Amount | Book Value as on 31-03-2026 |
|-----|-----------------------------------------|-------------|-----------------|-----------------------------|
| B   | In Other Trustee Securities             | - Nil -     | - Nil -         | - Nil -                     |
| C   | In Co-Operative Bank's Share            |             |                 |                             |
| 1   | Guj. State Co.Op. Bank Ltd.             | 5,000-00    | 5,000-00        | 5,000-00                    |
| 2   | Bhavnagar Dist. Co.Op.Bank Ltd.         | 1,06,000-00 | 1,06,000-00     | 1,06,000-00                 |
| 3   | NUCFDC - Equity Share                   | 1,00,000-00 | 1,00,000-00     | 1,00,000-00                 |
|     |                                         |             |                 | 2,11,000-00                 |
| D   | In Other Investment (as per Book-Value) | - Nil -     | - Nil -         | - Nil -                     |
|     | Total (A) + (B) + (C)                   |             |                 | 54,06,99,943-00             |

## એનેક્સર - VI : ધીરાણોનું પરિશિષ્ટ

| ક્રમ | ધિરાણનો પ્રકાર             | કુલ ધિરાણ       | તે પૈકી         |                | મુદતવિતી       |
|------|----------------------------|-----------------|-----------------|----------------|----------------|
|      |                            |                 | સીક્યોર્ડ       | અનસીક્યોર્ડ    |                |
| ૧    | ટુંકી મુદત                 |                 |                 |                |                |
|      | ૧. ગોલ્ડ લોન               | ૩૬,૮૪,૪૧૪-૦૦    | ૩૬,૮૪,૪૧૪-૦૦    | ---            | ---            |
|      | ૨. એસ.ઓ.ડી.                | ૧૨,૭૮,૬૨,૫૫૦-૭૦ | ૧૨,૭૮,૬૨,૫૫૦-૭૦ | ---            | ૧,૪૫,૮૫,૧૪૪-૭૩ |
|      | ૩. સી.સી.                  | ૬૧,૮૦૬-૦૦       | ---             | ૬૧,૮૦૬-૦૦      | ૬૧,૮૦૬-૦૦      |
|      | ૪. હાઈપો                   | ૧,૮૮,૬૦,૧૧૨-૭૫  | ૧,૮૮,૬૦,૧૧૨-૭૫  | ---            | ૧,૬૮,૬૩,૭૫૪-૦૦ |
|      | ૫. પ્લેજ                   | ૨,૦૨,૫૪,૧૬૧-૫૬  | ---             | ૨,૦૨,૫૪,૧૬૧-૫૬ | ૨,૦૨,૫૪,૧૬૧-૫૬ |
|      | ૬. એન.એચ.પી.               | ૮૮,૦૪,૨૪૬-૭૫    | ૮૮,૦૪,૨૪૬-૭૫    | ---            | ૭૩,૦૩,૬૭૮-૮૬   |
|      | ૭. સી.ઓ.ડી.                | ૧૭,૫૨,૦૨૭-૨૭    | ---             | ૧૭,૫૨,૦૨૭-૨૭   | ૮,૮૮,૩૧૦-૦૦    |
|      | ૮. ડેબીટ ઈન કરન્ટ એકાઉન્ટ  | ૮,૨૦,૮૮૪-૨૦     | ---             | ૮,૨૦,૮૮૪-૨૦    | ૮,૨૦,૮૮૪-૨૦    |
|      | ૯. બીલ્સ પરચેઝ             | ૩૩,૮૫,૦૦૦-૦૦    | ---             | ૩૩,૮૫,૦૦૦-૦૦   | ૩૩,૮૫,૦૦૦-૦૦   |
|      | ૧૦. ટી.ઓ.ડી.એફ.ડી.         | ૧૧,૩૧,૭૨૨-૭૪    | ૧૧,૩૧,૭૨૨-૭૪    | ---            | ---            |
|      |                            | ૧૮,૭૬,૨૭,૧૨૫-૯૭ | ૧૬,૧૩,૫૩,૦૪૬-૯૪ | ૨,૬૨,૭૪,૦૭૯-૦૩ | ૬,૪૩,૭૨,૯૪૦-૩૫ |
| ૨    | મધ્યમ મુદત                 |                 |                 |                |                |
|      | - સભાસદ લોન                | ૧,૦૩,૪૦૦-૦૦     | ૧,૦૩,૪૦૦-૦૦     | ---            | ૧,૦૩,૪૦૦-૦૦    |
| ૩    | લાંબી મુદત                 |                 |                 |                |                |
|      | ૧. સીક્યોર્ડ પ્રોપર્ટી લોન | ૧,૨૨,૨૮,૩૧૦-૦૦  | ૧,૨૨,૨૮,૩૧૦-૦૦  | ---            | ---            |
|      | ૨. સ્ટાફ હાઉસીંગ લોન       | ૧૦,૫૩,૨૬૩-૦૦    | ---             | ૧૦,૫૩,૨૬૩-૦૦   | ૮,૮૦,૩૨૨-૦૦    |
|      | ૩. કર્મચારી લોન            | ૧૮,૮૬,૩૪૮-૧૦    | ---             | ૧૮,૮૬,૩૪૮-૧૦   | ૧,૨૧,૮૧૨-૧૦    |
|      | ૪. હાઉસીંગ લોન             | ૨,૪૩,૭૫૩-૦૦     | ૨,૪૩,૭૫૩-૦૦     | ---            | ---            |
|      | ૫. સીક્યોર્ડ મશીનરી લોન    | ૨૩,૩૦,૨૮૧-૦૦    | ૨૩,૩૦,૨૮૧-૦૦    | ---            | ---            |
|      |                            | ૧,૭૮,૫૨,૮૫૫-૧૦  | ૧,૪૮,૦૩,૩૪૪-૦૦  | ૩૦,૪૮,૬૧૧-૧૦   | ૧૦,૧૨,૨૩૪-૧૦   |
|      |                            | ૨૦,૫૫,૮૩,૪૮૧-૦૭ | ૧૭,૬૨,૫૬,૭૯૦-૯૪ | ૨,૯૩,૨૩,૬૯૦-૧૩ | ૬,૫૪,૮૮,૫૭૪-૪૫ |

## એનેક્સર - VII : જમીન તથા મકાન બાંધકામ ઘસારો

| ક્રમ | વિગત                       | ૩૧-૦૩-૨૦૨૬   |
|------|----------------------------|--------------|
| ૧.   | મકાન બાંધકામ (બાદ : ઘસારો) | ૧,૩૩,૧૪૮-૦૦  |
| ૨.   | જમીન (મુળ કિંમતે)          | ૧૦,૪૮,૮૧૮-૦૦ |
|      |                            | ૧૧,૮૨,૯૬૭-૦૦ |

કમલ સી. મહેતા એન્ડ કંપની.

(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રમાણિત અન્વેષક)

FRN 104614W / M.NO.129801

જે.એમ.ચૌહાણ

મેનેજર

## એનેક્સર - VIII : કાયમી મીલ્કતો (ફર્નીચર..અન્ય)

(ઘસારો બાદ - નેટ કિંમતે)

| ક્રમ | વિગત                | ૩૧-૦૩-૨૦૨૬   |
|------|---------------------|--------------|
| ૧.   | ફર્નીચર ડેડ સ્ટોક   | ૨,૧૧,૭૩૮-૦૦  |
| ૨.   | લોકર                | ૮,૧૫,૦૮૮-૦૦  |
| ૩.   | મશીનરી              | ૪,૦૧,૪૫૩-૮૭  |
| ૪.   | કોમ્પ્યુટર્સ        | ૫૦,૨૧૨-૩૭    |
| ૫.   | સી.સી.ટી.વી. કેમેરા | ૮૮,૦૩૧-૦૭    |
|      |                     | ૧૫,૭૬,૫૩૪-૩૧ |

## Auditor's Report

To,  
All Members,  
Shree Botad Mercantile Co. Op. Bank Ltd.  
Botad.

### Report on the Financial Statements

1. I have audited the accompanying financial statements of Shree Botad Mercantile Cooperative Bank Limited which comprise the Balance Sheet as at 31st March 2026, Profit and Loss Account and Cash Flow Statement for the year then ended 31st March 2026, and a summary of significant accounting policies other explanatory information. The returns of four branches audited by me are incorporated in these financial statements.

### Management's Responsibility for the Financial Statements

2. Management is responsible for the preparation of these financial statements that gives a true and fair view of the financial position, financial performance and cash flow of the bank in accordance with the Banking Regulation Act, 1949 (as applicable to co-operative societies), the guidelines issued by the Reserve Bank of India and the guidelines issued by the Gujarat State Co-operative Society Act, 1961 (as applicable) and generally accepted accounting principles in India so far as applicable to the Bank. This Responsibility includes the design, implementation and maintenance of internal control relevant to the preparation of the financial statements that are free from material misstatement, whether due to fraud or error.

### Auditor's Responsibility

3. My responsibility is to express an opinion on these financial statements based on my audit. I have conducted audit in accordance with the Standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.
4. An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of Bank's internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the financial statements.
5. I believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for my audit opinion.

### Opinion

1. In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements with notes on accounts and Part (Bhag) 1 and 2 with observations thereon given the information required by the banking regulation Act 1949 (as applicable to co-operative societies). The Gujarat co-operative societies act 1961 and the guidelines issued by the national bank for Agricultural and rural development (as applicable) and guidelines issued by Reserve Bank of India and registrar of co-operative societies in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India,

(a) In case of the balance sheet of the state of affairs of the Bank as at 31st March, 2026 and

(b) In case of the profit and loss account of the PROFIT for the year ended on that date.

### Emphasis of Matters

1. We draw attention to the matters in the financial statements mentioned in detail in samanya shero part 1 and 2. The accounting policies followed by the bank and disclosures in respect of the matter mentioned in samanya shero part 1 and 2 are not in conformity with the accounting standards issued by the Institute of Chartered Accountants of India.
2. Our opinion is not qualified with respect to matter mentioned in samanya shero part 1.

### Report on other Legal and Regulatory Requirements

The balance sheet and profit and loss account have been drawn up in forms A and B respectively of the third schedule to the banking regulation Act 1949 and provisions of the Gujarat co-operative societies act 1961 and Gujarat co-operative societies rules 1965.

### We report that:

- (a) We have obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit and have found to be satisfactory.
- (b) In our opinion, proper books of account as required by law have been kept by the bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purpose of our audit have been received from the branches/offices.
- (c) The transaction of the bank which have been come to our notice are within the powers of the bank.
- (d) The Balance Sheet and the Profit and Loss account dealt with by this Report are in agreement with the books of account and returns.
- (e) The Accounting Standards adopted by the bank are consistent with those laid down by accounting principles generally accepted in India so far as applicable to Banks.

We further report that for the year under audit, the bank has been awarded "B" classification.

PLACE : Ahmedabad

DATE : 12-05-2026

For, KAMAL C. MEHTA & CO. (CHARTERED ACCOUNTANT)

FRN 104614W / M.NO.129801

UDIN NO.26129801KTBJZA2454



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## SHREE BOTAD MERCANTILE CO. OP. BANK LTD - BOTAD SIGNIFICANT ACCOUNTING POLICIES AND NOTES FORMING PARTS OF ACCOUNTS FINANCIAL YEAR : 2025-26

### 1. ACCOUNTING CONVENTION :

The financial statements are prepared by following the going concern concept on historical basis unless otherwise stated and confirm to statutory provision and practices prevailing in India.

### 2. USE OF ESTIMATES :

The preparation of financial statements requires the managements to make estimates and assumptions considered in the reported amount of assets and liabilities as of the financial statements and the reported income and expenses during the reporting period. Although these estimates are based upon the managements best knowledge action and Events Actual Result could be differ these estimates.

### 3. ADVANCES :

- As per the guidelines issued by the RBI, the advances to the borrower are classified into performing and non-performing assets based on recovery of the amount of principal and the interest and further the non-performing assets are classified into the Sub-Standard, Doubtful and the Loss Assets. The bank has made necessary provisions in respect of the Standard, Sub Standard, Doubtful and the Loss Assets as per RBI guidelines.
- Additional provisions carried in accounts over and above requirements under prudential norms prescribed by the Reserve Bank of India, which can be considered as earmarked reserve is as follows:
  - Bad & Doubtful Debts Provision u/s 36(1)(viii)
  - Bad & Doubtful Debts Reserve
- The overdue interest in respect of NPA advances is provided separately under Overdue Interest Reserve as per the directives issued by the RBI

### 4. FIXED ASSETS AND DEPRECIATION :

- Fixed assets are stated at their historical costs less accumulated depreciation. Costs include incidental expenses incurred on acquisition of assets.
- Premises and Other fixed assets (including land where the cost of land is not segregated) are depreciated on the written down value method at the following rates:

| Sr. No. | Particulars         | Rate of Depreciation |
|---------|---------------------|----------------------|
| 1       | Building            | 10 %                 |
| 2       | Furniture & Fixture | 10 %                 |

- Depreciation on Computers and Licensed Software's is provided at 40% & 25% on Written Down Value method as per RBI guidelines.

### 5. SEGMENT REPORTING :

In view of the management the bank is having only one kind of business and income i.e. banking, hence in the absence of reportable segment, disclosure required under segment reporting is not done.

### 6. INVESTMENTS :

- The entire investment portfolio of the bank is classified in accordance with the RBI guidelines, into three categories.
  - Held to maturity comprising of investments acquired with the intention to hold them till maturity.
  - Held for trading comprising of investments acquired with the intention to trade.
  - Available for sale comprising investments, which are not classified as per above two categories.
- Investments are further categorized as:
  - Central and State Government Securities
  - Shares of Co-Operative banks
  - Other approved securities
- Investments classified as held to maturity are carried at acquisition cost unless it is more than face value. Such premium paid required to be amortized over the period remaining to maturity, while bank has written off the premium in the year of investment made.
- Investment classified as held for trading and available for sale are marked to market script wise and the resultant depreciation is recognized in the profit and loss account. Net appreciation is ignored.
- Profit or loss on sale of investments held for trading and available for sale is taken to profit and loss account.
- Shifting from Held for Trading (HFT) category to Available for Sale (AFS) category is done at the Acquisition Cost or Book Value on the date of transfer, whichever is the least, and the depreciation, if any, on such transfer is provided.
- During the year under Audit, Bank have not upgraded or downgraded any of the Govt., Securities.

### 7. REVENUE RECOGNITION :

Income/Expenditure is accounted on accrual basis except the following which are accounted on cash basis

#### A. INCOME

- Interest income accounted on cash receipt basis for non-performing assets as per the RBI guidelines.
- Commission, brokerage, insurance commission, generally accounted for on cash basis.
- Dividend is recognized on cash basis.

#### B. EXPENDITURE

- The expenditure is accounted mainly on accrual basis, except insurance premium, computer and licensed software maintenance and any other equipment's maintenance on cash basis and provision for prepaid/unpaid is not made.

### 8. BORROWING COST :

There is no borrowing cost for acquiring capital assets during the year.

### 9. EMPLOYEE BENEFITS :

- For the future liabilities of the bank for the gratuity to the staff, bank has tied up with the LIC and obtained policy of gratuity.
- Leave encasement facility paid to the staff is provided for in the books of account on actual payment basis.
- Provident Fund contribution along with the staff contribution is remitted every month to actual payment basis recognized provident fund for the future benefit of the staff.

### 10. TAXATION :

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ.,બોટાદ



## A. Income Tax :

Normally, Income Tax is provided as per the provision of Income Tax Act, 1961. But, in there is carried forward Loss of previous year, Income tax provision is not required to be made.

## B. Deferred Tax :

Bank has not followed Accounting Standard 22 on "Accounting for Taxes on Income". Bank has not considered the issue of accounting for deferred taxes arising on account of timing difference between taxable income & accounting income that originate in one period and are capable of reversal in one or more subsequent periods

## 11. EVENTS OCCURRING AFTER THE BALANCE SHEET

Material adjusting events (that provides evidence of condition that existed at the balance sheet) occurring after the balance sheet date are recognized in the financial statements. Non adjusting events (that are indicative of the conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date represents material change and commitment affecting the financial position are disclosed in the report of the Board of Directors.

## 12. PROVISION

Provisions involving substantial degree of estimation in measurement are recognized when there is a present obligation as a result of past events and it is probable that there will be an outflow of resources even though the amount cannot be determined with certainty and represents only best estimate in the light of available information. Contingent Liabilities are not recognized but are disclosed in the notes. Contingent Assets are neither recognized nor disclosed in the financial statement.

## 13. IMPAIRMENT OF ASSETS

Impairment of Assets at each balance sheet, the bank assesses whether there is any indication than an asset may be impaired. If any indication exists, the recoverable amount of assets is estimated. An impairment loss is recognized immediately, when the carrying amount of an asset exceeds its recoverable amount. The recoverable amount is greater of net selling price and value in use in assessing value in use.

## 14. CASH BALANCE

Cash include cash on hand and balance with State Bank of India and the state/district co. op. Bank

## B. NOTES ON ACCOUNTS:

### 1. CHANGE IN ACCOUNTING POLICY

There is no change in accounting policies which have material effect and which requires adjustments in financial statements.

### 2. CONTINGENT LIABILITY

The contingent liability as per information & explanation provided by management are as under.

| Sr. No. | Particulars          | 31.03.2026     | 31.03.2025     |
|---------|----------------------|----------------|----------------|
| 1.      | Bills for Collection | ---            | ---            |
| 2.      | DEAF A/C             | 1,35,20,389.97 | 1,26,40,104.81 |
| 3.      | Staff Gratuity       | 1,46,291.00    | 6,63,813.00    |
| 4.      | Staff PF             | 18,86,627.00   | 17,66,730.00   |

### 3. DEPRECIATION ACCOUNTING (ACCOUNTING STANDARD-6)

Depreciation on fixed assets purchased before October 01 2025 during the year is charged to the profit & Loss statement at full rate applicable to respective asset while assets purchased after October 2025 are provided at half rate of respective assets.

Depreciation is not provided for on the assets sold /disposed of during accounting year, till the date of sale/ disposal as mandated by the accounting standard.

### 6. Investment Depreciation Fund (IDR)

As on 31.03.2026, the bank has a shortfall in the market cap of GOI securities, Rs. 69,92,000.00 has been transferred to IDR by taking the below line from IFR.

### 7. FOREIGN EXCHANGE TRANSACTION

Bank has not entered into any foreign currency transaction during the year.

### 8. REFROUPEING OF PREVIOUS YEAR FIGURES

Previous year figures have been regrouped or rearranged wherever Necessary to confirm with the presentation of the accounts of the Current year.

### 9. PAYMENT OF DICGC INSURANCE PREMIUM

Bank has paid DICGC Premium of Rs. 8,13,156.55 During the year.

### 10. INCOME TAX

Income Tax provision for A.Y.2025-26 of Rs.34,01,636.00 is made as During the year; the bank has carried forward Loss of Previous year for setoff.

### 11. ACCOUNTING ON TAXES ON INCOME

Provision for current year is determined as the amount of tax payable in respect of taxable income for the year. Deferred tax is not recognized on timing difference between the accounting income and the tax income that originates in one period and is capable of reversal in one or more subsequent period. Backup of deferred tax assets/liabilities is given here.

| Particulars | Opening balance | Add during year |     | Less during year | Closing Balance |
|-------------|-----------------|-----------------|-----|------------------|-----------------|
|             |                 |                 | Nil |                  |                 |

## 12. CASH FLOW STATEMENT:

The Bank have not prepared Cash Flow statement for the year 2025-26.

PLACE : Ahmedabad  
DATE : 12-05-2026

For, KAMAL C. MEHTA & CO.(CHARTERED ACCOUNTANT)  
FRN 104614W / M.NO.129801  
UDIN NO.26129801KTBJZA2454



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## ANNEXURE III

### DISCLOSURE IN FINANCIAL STATEMENTS - "NOTES TO ACCOUNTS" 2025-26

#### 1. (a) REGULATORY CAPITAL

| Sr.No. | Particular                                                                                                                                                                                                                                                                                               | Current Year | Previous Year |
|--------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| i)     | Common Equity Tier 1 Capital (CET 1)* / Paid up Share Capital and reserves@ (net of deductions, if any)                                                                                                                                                                                                  | 11.05        | 8.59          |
| ii)    | Additional Tier 1 Capital* / Other Tier 1 Capital*                                                                                                                                                                                                                                                       | 0.00         | 0.00          |
| iii)   | Tier 1 Capital (i+ii)                                                                                                                                                                                                                                                                                    | 11.05        | 8.59          |
| iv)    | Tier 2                                                                                                                                                                                                                                                                                                   | 2.28         | 2.05          |
| v)     | Total Capital (Tier 1+Tier 2)                                                                                                                                                                                                                                                                            | 13.33        | 10.64         |
| vi)    | Total Risk Weighted (RWAs)                                                                                                                                                                                                                                                                               | 16.99        | 17.68         |
| vii)   | CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)* / Paid-Up share capital and reserves as percentage of RWAs@)                                                                                                                                                                                                | —            | —             |
| viii)  | Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)                                                                                                                                                                                                                                                    | 65.04%       | 48.58%        |
| ix)    | Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)                                                                                                                                                                                                                                                    | 13.42 %      | 11.61%        |
| x)     | Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)                                                                                                                                                                                                                     | 78.46%       | 60.19%        |
| xi)    | Leverage Ratio*                                                                                                                                                                                                                                                                                          | —            | —             |
| Xii)   | Percentage of the shareholding of<br>a) Government of India<br>b) State Government (specify name)s<br>c) Sponsor Banks                                                                                                                                                                                   | —            | —             |
| Xiii)  | Amount of paid-up equity capital raised during the year                                                                                                                                                                                                                                                  | —            | —             |
| xiv)   | Amount of non-equity Tier 1 capital raised during the year, of which :<br>Give list as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc. ). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant. | —            | —             |
| xv)    | Amount of Tier 2 capital raised during the year, of which :<br>Give list as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc. ). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.            | —            | —             |

## 1. (b) Draw down from Reserves

| Sr.No. | Type of Reserve | Drawdown    | Remarks                                                                                                                                                                                                  |
|--------|-----------------|-------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1      | Education Fee   | 1,00,000-00 | Payment toward Education fund as per board approval                                                                                                                                                      |
| 2      | IFR To IDR      | 69,92,000/- | The market loss of the bank's AFS Securities is Rs.75,36,337.00, hence the funds remaining in IFR, which is more than 5% of the funds, have been transferred to IDR. as per AFS, 5% of IFR is remaining. |

### Notes :-

The Reserve Bank of India conducted an audit up to the year 2021, in which a penalty of Rs. 25,000.00 was imposed on the bank on 22.09.2022 under loans and advances to directors etc., the penalty amount was sent through NEFT on 26.09.2022.

## 2. Asset Liability Management

### (a) Maturity pattern of certain items of assets and liabilities

(Amount in Crore)

|                              | 1 to 14 days | 15 to 28 days | 29 days to 3 months | Over 3 months and up to 6 months | Over 6 months and up to 1 Year | Over 1 year and up to 3 Year | Over 3 year and up to 5 Year | Over 5 Year | Total |
|------------------------------|--------------|---------------|---------------------|----------------------------------|--------------------------------|------------------------------|------------------------------|-------------|-------|
| Deposits                     | 4.42         | 1.37          | 5.19                | 5.48                             | 11.45                          | 29.88                        | 0.00                         | 0.00        | 57.79 |
| Advance                      | 0.04         | 0.01          | 0.17                | 0.25                             | 12.27                          | 0.81                         | 0.68                         | 6.33        | 20.56 |
| Investments                  | 0.00         | 0.00          | 1.48                | 0.00                             | 10.78                          | 8.07                         | 3.48                         | 30.26       | 54.07 |
| Borrowings                   | 0            | 0             | 0                   | 0                                | 0                              | 0                            | 0                            | 0           | 0     |
| Foreign Currency Assets      | 0            | 0             | 0                   | 0                                | 0                              | 0                            | 0                            | 0           | 0     |
| Foreign Currency Liabilities | 0            | 0             | 0                   | 0                                | 0                              | 0                            | 0                            | 0           | 0     |

### 2. Asset Liability Management

#### (b) Liquidity Coverage Ration (LCR)

NIL

### 2. Asset Liability Management

#### (c) Net Stable Funding Ratio (NSFR)

NIL



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ લેંક લિ., બોટાદ

## 3. Investment

### (a) Composition of Investment Portfolio

(Amount in Crore)

|                                                       | Investments in India |                           |        |                                    |                                 |        |                     | Investments Outside India                     |                                 |        |                          |                  |
|-------------------------------------------------------|----------------------|---------------------------|--------|------------------------------------|---------------------------------|--------|---------------------|-----------------------------------------------|---------------------------------|--------|--------------------------|------------------|
|                                                       | Gov. Securities      | Other Approved Securities | Shares | Debentures and Bonds - MUTUAL FUND | Susidiaries &/or joint ventures | Others | Total Inv. in India | Gov. Securities (including local authorities) | Susidiaries &/or joint ventures | Others | Total Inv. Outside India | Total Investment |
| <b>Held to Maturity</b>                               |                      |                           |        |                                    |                                 |        |                     | NIL                                           |                                 |        |                          |                  |
| Gross                                                 | 11.90                | 5.00                      | 0.02   | -                                  | 0.00                            | -      | 16.92               |                                               |                                 |        |                          |                  |
| Less : Provision for non per morning Investment (NPI) | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Net                                                   | 11.90                | 5.00                      | 0.02   | -                                  | 0.00                            | -      | 16.92               |                                               |                                 |        |                          |                  |
| <b>Available for Sale</b>                             | 42.15                | 0.00                      | 0.00   |                                    | 0.00                            |        | 42.15               |                                               |                                 |        |                          |                  |
| Gross                                                 | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Less : Provision for non per morning Investment (NPI) | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Net                                                   | 42.15                | 0.00                      | 0.00   | 0.00                               | 0.00                            | -      | 42.15               |                                               |                                 |        |                          |                  |
| <b>Held for Trading</b>                               |                      |                           |        |                                    |                                 |        |                     |                                               |                                 |        |                          |                  |
| Gross                                                 | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Less : Provision for non per morning Investment (NPI) | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Net                                                   | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| <b>Total Investment</b>                               | 54.05                | 5.00                      | 0.02   | 0.00                               | 0.00                            |        | 59.07               |                                               |                                 |        |                          |                  |
| Less : Provision for non per morning Investment (NPI) | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Less : Provision for depreciation and NPI             | -                    | -                         | -      | -                                  | -                               | -      | -                   |                                               |                                 |        |                          |                  |
| Net                                                   | 54.05                | 5.00                      | 0.02   | 0.00                               | 0.00                            | -      | 59.07               |                                               |                                 |        |                          |                  |

## 3. Investment

### (b) Movement of provisions for Depreciation and Investment Fluctuation Reserve

(Amount in Crore)

| Particular                                                                                                           | Current Year | Previous Year |
|----------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| <b>(i) Movement of provisions held towards Depreciation on Investment</b>                                            |              |               |
| a) Opening Balance                                                                                                   | 0.00         | 0.35          |
| b) Add : Provision made during the year                                                                              | 0.75         | 0.00          |
| c) Less : Write off / Write back of excess provisions during the year                                                | 0.00         | 0.35          |
| d) Closing Balance                                                                                                   | 0.75         | 0.00          |
| <b>(ii) Movement of Investment Fluctuation Reserve</b>                                                               |              |               |
| a) Opening Balance                                                                                                   | 2.22         | 1.95          |
| b) Add : Amount transferred during the year                                                                          | 0.54         | 0.27          |
| c) Less : Drawdown                                                                                                   | -0.69        | 0.00          |
| d) Closing Balance                                                                                                   | 2.07         | 2.22          |
| <b>(iii) Clising balance in IFR as a percentage of closing balance of investment in AFS and HFT/Current category</b> |              |               |

## 3. Investment

### (d) Non - SLR Investment Portfolio

#### (i) Non - per morning non - SLR investment

(Amount in Crore)

| Sr.No. | Particular                                 | Current Year | Previous Year |
|--------|--------------------------------------------|--------------|---------------|
| a)     | Opening Balance                            | NIL          |               |
| b)     | Additional during the year since 1st April |              |               |
| c)     | Recuctions during the above period         |              |               |
| d)     | Closing balance                            |              |               |
| e)     | Total Provisions held                      |              |               |

#### (ii) Issuer composition of non - SLR Investment

(Amount in Crore)

| Sr.No. | Issuer                              | Amount       |               | Extenet of Privet Placement |               | Extenet of 'Grade Investment Grade' Securities |               | Extenet of 'Unrated' Securities |               | Extenet of 'Unlisted' Securities |               |
|--------|-------------------------------------|--------------|---------------|-----------------------------|---------------|------------------------------------------------|---------------|---------------------------------|---------------|----------------------------------|---------------|
| 1      | 2                                   | 3            |               | 4                           |               | 5                                              |               | 6                               |               | 7                                |               |
|        |                                     | Current Year | Previous Year | Current Year                | Previous Year | Current Year                                   | Previous Year | Current Year                    | Previous Year | Current Year                     | Previous Year |
| a)     | PSUs                                | 0.00         | 0.00          | NIL                         |               |                                                |               |                                 |               |                                  |               |
| b)     | FIs                                 |              |               |                             |               |                                                |               |                                 |               |                                  |               |
| c)     | Banks                               | 5.00         | 5.00          |                             |               |                                                |               |                                 |               |                                  |               |
| d)     | Private Corporate                   |              |               |                             |               |                                                |               |                                 |               |                                  |               |
| e)     | Subsidiaries/ Joint Ventures        |              |               |                             |               |                                                |               |                                 |               |                                  |               |
| f)     | Others                              | 0.02         | 0.02          |                             |               |                                                |               |                                 |               |                                  |               |
| g)     | Provisions hel towards depreciation |              |               |                             |               |                                                |               |                                 |               |                                  |               |
|        | Total*                              | 5.02         | 5.02          |                             |               |                                                |               |                                 |               |                                  |               |

## 3. Investment

### (e) Repo transaction (in face value terms)

(Amount in Crore)

|                                              | Minimum Outstanding during the year | Maximum Outstanding during the year | Daily average Outstanding during the year | Outstanding as on March 31 |
|----------------------------------------------|-------------------------------------|-------------------------------------|-------------------------------------------|----------------------------|
| (i) Securities sold under Repo               | NIL                                 |                                     |                                           |                            |
| a) Government Securities                     |                                     |                                     |                                           |                            |
| b) Corporate debt Securities                 |                                     |                                     |                                           |                            |
| c) Any other Securities                      |                                     |                                     |                                           |                            |
| (ii) Securities purchased under Reverse repo |                                     |                                     |                                           |                            |
| a) Government Securities                     |                                     |                                     |                                           |                            |
| b) Corporate debt Securities                 |                                     |                                     |                                           |                            |
| c) Any other Securities                      |                                     |                                     |                                           |                            |



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## 4. Asset Quality

### (a) Classification of advance and provision held

|                                                                                                | Standard               | Non Performing       |          |      |                              | Total |
|------------------------------------------------------------------------------------------------|------------------------|----------------------|----------|------|------------------------------|-------|
|                                                                                                | Total Standard Advance | Sub-Standard         | Doutfull | Loss | Total Non Performing Advance |       |
| <b>Gross Standard Advances and NPAs</b>                                                        |                        |                      |          |      |                              |       |
| Opening Balance                                                                                | 12.83                  | 0.99                 | 1.89     | 4.01 | 6.89                         | 19.72 |
| Add : Additional during the year                                                               | 1.17                   | 0.11                 | 0.52     | 0.00 | 0.63                         | 1.80  |
| Less : Rductions during the year*                                                              | 0.00                   | 0.87                 | 0.01     | 0.10 | 0.98                         | 0.98  |
| Closing Balance                                                                                | 14.00                  | 0.23                 | 2.40     | 3.91 | 6.54                         | 20.54 |
| * Reductios in Gross NPAs due to :                                                             |                        |                      |          |      |                              |       |
| i) Upgradation                                                                                 | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| ii) Reoveries (excluding recoveries from Upgraded Accounts)                                    | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| iii) Techincal/Prudential Write-offs                                                           | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| iv) Write-offs other than those under (iii) above                                              | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| <b>Provisions (excluding Floating Provisions)</b>                                              |                        |                      |          |      |                              | 0.00  |
| Opening Balance of provisions held                                                             | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| Add : Fresh provisions made during the year                                                    | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| Less: Excess provision reversed/Write off loans                                                | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| Closing balance of Provisions held                                                             | 0.00                   | 0.00                 | 0.00     | 0.00 | 0.00                         | 0.00  |
| <b>Net NPAs</b>                                                                                | NIL                    |                      |          |      |                              |       |
| Opening Balance                                                                                |                        |                      |          |      |                              |       |
| Add : Fresh additionas during the year                                                         |                        |                      |          |      |                              |       |
| Less: Reduction during the year                                                                |                        |                      |          |      |                              |       |
| Closing balance                                                                                |                        |                      |          |      |                              |       |
| <b>Floating Provisions</b>                                                                     |                        |                      |          |      |                              |       |
| Opening Balance                                                                                |                        |                      |          |      |                              |       |
| Add : Additional Provisions made during the year                                               |                        |                      |          |      |                              |       |
| Less : Amount drawn donw during the year                                                       |                        |                      |          |      |                              |       |
| Closing Balance of floating provisions                                                         |                        |                      |          |      |                              |       |
| <b>Technical Write-offs and the recoveries made thereon</b>                                    |                        |                      |          |      |                              |       |
| Opening Balance of Techincal/Prudential Written off accounts                                   |                        |                      |          |      |                              |       |
| Add : Technical/Prudential Write-offs during the year                                          |                        |                      |          |      |                              |       |
| Less: Recoverys made from previously technical/prudential written-off accounts during the year |                        |                      |          |      |                              |       |
| Closing balance                                                                                |                        |                      |          |      |                              | 0.00  |
| <b>Ratios (in %)</b>                                                                           | <b>Current Year</b>    | <b>Previous Year</b> |          |      |                              |       |
| Gross NPA to Gross Advances                                                                    | 31.85%                 | 34.96%               |          |      |                              |       |
| Net NPA to Net Advances                                                                        | 0.00%                  | 0.00%                |          |      |                              |       |
| Provisions coverage ration                                                                     |                        |                      |          |      |                              |       |

## 4. Asset Quality

### (b) Sector - Wise Advance and Gross NPAs

| Sr.No. | Sector                                                            | Current Year               |            |                                                           | Previous Year              |            |                                                           |
|--------|-------------------------------------------------------------------|----------------------------|------------|-----------------------------------------------------------|----------------------------|------------|-----------------------------------------------------------|
|        |                                                                   | Outstanding Total Advances | Gross NPAs | Percentage of Gross NPAs to Total Advances in that sector | Outstanding Total Advances | Gross NPAs | Percentage of Gross NPAs to Total Advances in that sector |
| i)     | <b>Priority Sector</b>                                            |                            |            |                                                           |                            |            |                                                           |
| a)     | Agriculture and allied activities                                 |                            |            |                                                           |                            |            |                                                           |
| b)     | Advances to industries sector eligible as Priority sector lending | 12.35                      | 0.68       |                                                           | 13.10                      | 1.85       |                                                           |
| c)     | Servisies                                                         | 0.00                       | 0.00       | -                                                         | 0.02                       | 0.00       | -                                                         |
| d)     | Personal loans                                                    | 0.01                       | 0.30       |                                                           | 0.00                       | 0.00       |                                                           |
|        | Subtotal (i)                                                      | 12.36                      | 0.98       | -                                                         | 13.12                      | 1.85       | -                                                         |
| ii)    | <b>Non-priority Sector</b>                                        |                            |            |                                                           |                            |            |                                                           |
| a)     | Agricultrue and allied activities                                 | 0.00                       | 0.00       |                                                           | 0.00                       | 0.00       |                                                           |
| b)     | Industry                                                          | 0.00                       | 0.00       |                                                           | 5.85                       | 4.53       |                                                           |
| c)     | Servisies                                                         | 7.04                       | 4.97       | -                                                         | 0.76                       | 0.52       | -                                                         |
| d)     | Personal loans                                                    | 1.16                       | 0.60       |                                                           | 0.00                       | 0.00       |                                                           |
|        | Subtotal (ii)                                                     | 8.20                       | 5.57       |                                                           | 6.61                       | 5.05       |                                                           |
|        | Total (i+ii)                                                      | 20.56                      | 6.55       | -                                                         | 19.73                      | 6.90       | -                                                         |

## 4. Asset Quality

### (c) Overseas assets, NPAs and revenue

}

NIL

## 4. Asset Quality

### (d) Particulars of resolution plan and restructuring

}

NIL

#### (i) Particulars of resolution plan

#### (ii) Details of account subjected to restructuring

}

NIL

## 4. Asset Quality

### (e) Divergence in asset classification and provisining

}

NIL

## 4. Asset Quality

### (f) Disclosure of transfer fo loan exposures

}

NIL

## 4. Asset Quality

### (g) Fraud Account

(Amount in Crore)

| Particular                                                                                           | Current Year | Previous Year |
|------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| Number of Fraud Reported                                                                             | -            | -             |
| Amount involved in Fraud (Rs. Crore)                                                                 | -            | -             |
| Amount of Provision made for such Fraud (Rs. Crore)                                                  | -            | -             |
| Amount of Unamortised provisions debited from 'other reserves' as at the end of the year (Rs. Crore) | -            | -             |

## 4. Asset Quality

### (h) Format for disclosure to be made half yearly starting September 30, 2026 AS ON 31-03-2026

}

NIL



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## 5. Exposures

### (a) Exposure to real estate sector

(Amount in Crore)

| Category                                                                                                                                                                                                                                                                                                                                                                                       | Current Year | Previous Year |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| <b>i) Direct Exposure</b>                                                                                                                                                                                                                                                                                                                                                                      |              |               |
| <b>a) Residential Mortgages -</b><br>Lending fully secured by Mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non-fund based (NFB) limits.                                                                 |              |               |
| <b>b) Commercial Real Estate -</b><br>Lending secured by mortgages on commercial real estate (office buildings, retails space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and construction, etc.). Exposure would also included non-fund based(NFB) limits. |              |               |
| <b>c) Investments in Mortgage-Backed Securities (MBS) and other Securitised exposures -</b><br>i) Residential<br>ii) Commercial Real Estate                                                                                                                                                                                                                                                    |              |               |
| <b>ii) Indirect Exposure</b><br>Fund based and non-fund-based exposures on National Housing Bank and Housing Finance Companies                                                                                                                                                                                                                                                                 | 14.24        | 13.32         |
| <b>Total Exposure to Real Estate Sector</b>                                                                                                                                                                                                                                                                                                                                                    | <b>14.24</b> | <b>13.32</b>  |

## 5. Exposures

### (b) Exposure to Capital Market

|   |     |
|---|-----|
| } | NIL |
|---|-----|

## 5. Exposures

### (c) Risk category-wise country exposure

|   |                  |
|---|------------------|
| } | (Not applicable) |
|---|------------------|

## 5. Exposures

### (d) Unsecured Advance

| Particulars                                                                                                                                    | Current Year | Previous Year |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| Total unsecured advances of the bank                                                                                                           | 2.8          | 2.94          |
| Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken | Nil          | Nil           |
| Estimated value of such intangible securities                                                                                                  | Nil          | Nil           |

## 5. Exposures

### (e) Factoring exposures

|   |     |
|---|-----|
| } | NIL |
|---|-----|

## 5. Exposures

### (f) Intra-group exposures

|   |     |
|---|-----|
| } | NIL |
|---|-----|

## 5. Exposures

### (g) Unhedged foreign currency exposure

|   |     |
|---|-----|
| } | NIL |
|---|-----|

## 6. Concentration of deposits, advance, exposures and NPAs

### (a) Concentration of Deposits

(Amount in Crore)

| Particulars                                                                     | Current Year | Previous Year |
|---------------------------------------------------------------------------------|--------------|---------------|
| Total Deposits of the twenty largest depositors                                 | 6.8          | 7.89          |
| Percentage of deposits of twenty largest deposits to total deposits of the bank | 11.77%       | 13.69%        |

### (b) Concentration of Advances

(Amount in Crore)

| Particulars                                                                    | Current Year | Previous Year |
|--------------------------------------------------------------------------------|--------------|---------------|
| Total Advances of the twenty largest borrowers                                 | 6.97         | 7.00          |
| Percentage of advance of twenty largest borrowers to total advance of the bank | 33.92%       | 35.50%        |

### (c) Concentration of exposures

(Amount in Crore)

| Particulars                                                                                                               | Current Year | Previous Year |
|---------------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
| Total exposures of the twenty largest borrowers / customers                                                               | 3.63         | 3.60          |
| Percentage of exposures of twenty largest borrowers /customers to the total exposure of the bank on borrowers / customers | 18.66%       | 18.24%        |

### (d) Concentration of NPAs

(Amount in Crore)

| Particulars                                                                   | Current Year | Previous Year |
|-------------------------------------------------------------------------------|--------------|---------------|
| Total exposure of the twenty NPA accounts                                     | 4.22         | 4.47          |
| Percentage of exposure to the twenty largest NPA exposure to total gross NPAs | 64.43%       | 64.87%        |

## 7. Derivatives

### (a) Forward rate agreement / Interest rate swap

NIL

### (b) Exchange traded interest rate derivatives

NIL

### (c) Disclosure on risk exposure in derivatives

#### (i) Qualitative disclosure

NIL

#### (ii) Qualitative disclosure

NIL

### (d) Credit default swaps

NIL

## 8. Disclosure relating to securitisation

NIL

## 9. Off balance sheet SPVs sponsored

(which are required to be consolidated as per accounting norms)

NIL

## 10. Transfer to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amount in Crore)

| Particulars                                           | Current Year | Previous Year |
|-------------------------------------------------------|--------------|---------------|
| Opening balance of amounts transferred to DEA Fund    | 1.26         | 1.14          |
| Add : Amounts transferred to DEA Fund during the year | 0.11         | 0.15          |
| Less : Amounts reimbursed by DEA Fund towards claims  | -0.02        | -0.03         |
| Closing balance of amounts transferred to DEA Fund    | 1.35         | 1.26          |



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## 11. Disclosure of Complaints

### (a) Summary information on complaints received by the bank from customers and from the offices of ombudsman

(Amount in Crore)

| Sr.No. | Particulars                                                                                                         | Current Year | Previous Year |
|--------|---------------------------------------------------------------------------------------------------------------------|--------------|---------------|
|        | Complaints received by the bank from its customers                                                                  |              |               |
| 1      | Numbers of complaints pending at beginning of the year                                                              | -            | -             |
| 2      | Numbers of complaints received during the year                                                                      | -            | -             |
| 3      | Numbers of Complaints disposed during the year                                                                      | -            | -             |
| 4      | 3.1 of Which, Number of Complaints rejected by the bank                                                             | -            | -             |
|        | Maintainable Complaints received by the bank from office of ombudsman                                               |              |               |
| 5      | Numbers of maintainable complaints received by the bank from office of ombudsman                                    | 01           | -             |
|        | 5.1 of 5, number of complaints resolved in favour of the bank by office of ombudsman                                | 01           | -             |
|        | 5.2 of 5, number of complaints resolved through conciliation / mediation / advisories issued by office of ombudsman | -            | -             |
|        | 5.3 of 5, number of complaints resolved after passing of Awards by office of ombudsman agents the bank              | -            | -             |
| 6      | Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)                               | -            | -             |

## 11. Disclosure of Complaints

### (b) Top five grounds of complaints received by the bank from customers

| Grounds of complaints, (i.e complaints relating to) | Numbers of complaints pending at the beginning of the year | Numbers of complaints pending at the beginning of the year | % Increase / decrease in the number of complaints received over the previous year | Numbers of complaints pending at the beginning of the year | Of 5, number of complaints pending beyond 30 days |
|-----------------------------------------------------|------------------------------------------------------------|------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------|------------------------------------------------------------|---------------------------------------------------|
| Current Year                                        |                                                            |                                                            |                                                                                   |                                                            |                                                   |
| Ground - 1                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 2                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 3                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 4                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 5                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Other                                               | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Total                                               | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Previous Year                                       |                                                            |                                                            |                                                                                   |                                                            |                                                   |
| Ground - 1                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 2                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 3                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 4                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Ground - 5                                          | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Other                                               | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |
| Total                                               | -                                                          | -                                                          | -                                                                                 | -                                                          | -                                                 |

## 12. Disclosure of penalties imposed by the Reserve Bank of India

Penalties imposed by the Reserve Bank of India under the provisions of the (i) Banking Regulation Act, 1949 (ii) Payment and Settlement Systems Act, 2007 and (iii) Government Securities Act, 2006 (for bouncing of SGL) shall be disclosed in the 'Notes to Accounts' to the balance sheet in the concerned bank's next Annual Report. In the case of foreign bank, the penalty shall be disclosed in the 'Notes to accounts' to the next balance sheet for its Indian operations.

Banks shall make appropriate disclosures on the nature of the breach, number of instance of default and the quantum of penalty imposed.

The defaulting participant in a reverse repo transaction shall make appropriate disclosure on the number of instance of default as well as the quantum of penalty paid to the Reserve Bank of India during the financial year.

## 13. Disclosure on remuneration

Not Applicable UCB)

## 14. Other Disclosures

### (a) Business Ratio

(Amount in Crore)

| Particulars                                                       | Current Year | Previous Year |
|-------------------------------------------------------------------|--------------|---------------|
| i) Interest Incomes as percentage to Working Funds                | 6.44%        | 6.74%         |
| ii) Non-Interest income as a percentage to Working Funds          | 0.08%        | 0.10%         |
| iii) Cost of Deposits                                             | 4.24%        | 4.41%         |
| iv) Net Interest Margin                                           | 4.25%        | 6.19%         |
| v) Operating profit as a percentage to Working Funds              | 1.79%        | 1.84%         |
| vi) Return on Assets                                              | 1.23%        | 1.29%         |
| vii) Business (deposit plus advances) per employee (in Rs. crore) | 0.93         | 0.89          |
| viii) Profit per employee (in Rs. crore)                          | 0.04         | 0.05          |

### (b) Bancassurance Business

The details of fees / brokerage earned in respect of insurance broking, agency and bancassurance business undertaken by them shall be disclosed for both the current year and previous year

NIL

### (c) Marketing and distribution

Bank shall disclose the details of fees/remuneration received in respect of the marketing and distribution function (excluding bancassurance business) undertaken by them

NIL

### (d) Disclosures regarding priority sector Lending certificates (PSLCs)

The amount of PSLCs (category-wise) sold and purchased during the year shall be disclosed

NIL

### (e) Provisions and contingencies

(Amount in Crore)

| Provisions debited to Profit and Loss Account         | Current Year | Previous Year |
|-------------------------------------------------------|--------------|---------------|
| i) Provisions for NPI                                 | 0.00         | 0.00          |
| ii) Provisions towards NPA                            | 0.01         | 0.08          |
| iii) Provisions made towards Income Tax               | 0.34         | 0.37          |
| iv) Other Provisions and Contingencies (with details) | 0.75         | 0.07          |

### (f) Implementations of IFRS converged Indian Accounting Standards (Ind As)

(Not applicable UCB)

### (g) Payment of DICGC Insurance Premium

(Amount in Crore)

| Sr.No. | Particulars                         | Current Year | Previous Year |
|--------|-------------------------------------|--------------|---------------|
| 1      | Payment of DICGC Insurance Premium  | 29-10-25     | 07-10-24      |
| 2      | Arrears in Payment of DICGC Premium | -            | -             |

### (h) Disclosure of facilities granted to director and their relatives

UCBs shall disclose any fund or non-fund (guarantees, letters of credit, etc.) facilities extended to director, their relative, companies or firms in which they are interested.

NIL

### (i) Disclosure on amortisation of expenditure on account of enhancement in family pension of employee of banks



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

## BALANCE SHEET OF BANKS - DISCLOSURE OF INFORMATION

1. Capital to Risk Weight Asset Ratio. (CRAR) :- As on 31 March 2026
2. Movement of CRAR :- **78.46%**
3. Investments :
  - a. Book value and Face value of investments Rs.**5501.20** lakh Rs.**5404.88** lakh
  - b. Market value of investments Rs.**5343.51** lakh
  - c. Details of Issuer composition of non- SLR investments and Non performing non- SLR Investments.

### i.Issuer Composition of Non SLR Investments

(Rs. in Crore)

| No. | Issuer                              | Amount | Extent of Below 'Investment Grade Securities' | Extent of 'Unrated Securities' | Extent of 'Unrated Securities' |
|-----|-------------------------------------|--------|-----------------------------------------------|--------------------------------|--------------------------------|
| (1) | (2)                                 | (3)    | (4)                                           | (5)                            | (6)                            |
| 1   | PSUs                                | -      | -                                             | -                              | -                              |
| 2   | FIs                                 | -      | -                                             | -                              | -                              |
| 3   | Public Sector Banks                 | -      | -                                             | -                              | -                              |
| 4   | Mutual Funds                        | -      | -                                             | -                              | -                              |
| 5   | Others                              | -      | -                                             | -                              | -                              |
| 6   | Provision Held towards Depreciation | -      | -                                             | -                              | -                              |

### i.Issuer Composition of Non SLR Investments

| Particulars                               | Amount (Rs. in Crore) |
|-------------------------------------------|-----------------------|
| Opening Balance                           | -                     |
| Additions during the year since 1st April | -                     |
| Reduction during the above period         | -                     |
| Closing Balance                           | -                     |
| Total Provisions held                     | -                     |

4. Advances against :
 

|                       |              |
|-----------------------|--------------|
| Real estate           | Rs. --- lakh |
| Construction business | Rs. --- lakh |
| Housing               | Rs. --- lakh |
5. Advances against shares & debentures
6. Advances to directors, their relatives, companies / firms in which they are interested :
  - a. Fund - based. Rs. --- lakh
  - b. Non - fund based (Guarantees, L / C, etc.) Rs. --- lakh
7. Cost of Deposits : Average cost of deposits
8. NPAs :
 

|               |                        |
|---------------|------------------------|
| a. Gross NPAs | Rs. <b>654.89</b> lakh |
| b. Net NPAs   | RS.0.00 % lakh         |
9. Movement in NPAs
 

|            |                        |                        |
|------------|------------------------|------------------------|
|            | 31.03.2025             | 31.03.2026             |
| Gross NPAs | Rs. <b>689.69</b> lakh | Rs. <b>654.89</b> lakh |
| Net NPAs   | Rs.0.00 % lakh         | Rs.0.00 % lakh         |
- Profitability :
 

|                                                           |               |
|-----------------------------------------------------------|---------------|
| a. Interest income as a percentage of working funds       | <b>6.44 %</b> |
| b. Non - interest income as a percentage of working funds | <b>0.08 %</b> |
| c. Operating profit as a percentage of working funds      | <b>1.79 %</b> |
| d. Return on Assets                                       | <b>1.23 %</b> |

|     |                                                                                   |                                |                                                                   |
|-----|-----------------------------------------------------------------------------------|--------------------------------|-------------------------------------------------------------------|
|     | e. Business (Deposits + Advances) per employee                                    |                                | <b>Rs.356.12</b>                                                  |
|     | f. Profit per employee                                                            |                                | <b>Rs.4.00</b>                                                    |
| 10. | Provisions made towards<br>NPAs<br>Depreciation in investments<br>Standard Assets |                                | <b>Rs.1.13 lakh</b><br><b>Rs. --- lakh</b><br><b>Rs. --- lakh</b> |
| 11. | Movement in provisions :                                                          | 31.03.2025                     | 31.03.2026                                                        |
|     | a. Towards NPAs                                                                   | Rs. 8.77 lakh                  | <b>Rs.1.13 lakh</b>                                               |
|     | b. Towards depreciation on investments                                            | <b>Rs.--- lakh</b>             | Rs 75.37 lakh                                                     |
|     | c. Towards standard assets                                                        | Rs. ---- lakh                  | <b>Rs. --- lakh</b>                                               |
| 12. | Foreign currency assets & liabilities : (if applicable)                           |                                |                                                                   |
| 13. | Payment of DICGC Insurance Premium                                                | <b>Dt.29-10-2025(March 26)</b> |                                                                   |
| 14. | Penalty imposed by RBI                                                            | ---                            |                                                                   |
| 15. | Restructured Accounts                                                             |                                | (Rs. in Crore)                                                    |

| Particulars of Account Restructured |                                          |              |                        |        |
|-------------------------------------|------------------------------------------|--------------|------------------------|--------|
|                                     |                                          | Housing Loan | SME Debt Restructuring | Others |
| Standard Advances Restructured      | Number of Borrowers                      | -            | -                      | -      |
|                                     | Amount Outstanding                       | -            | -                      | -      |
|                                     | Sacrifice (diminution in the fair value) | -            | -                      | -      |
| Sub Standard Advances Restructured  | Number of Borrowers                      | -            | -                      | -      |
|                                     | Amount Outstanding                       | -            | -                      | -      |
|                                     | Sacrifice (diminution in the fair value) | -            | -                      | -      |
| Doubtful Advances Restructured      | Number of Borrowers                      | -            | -                      | -      |
|                                     | Amount Outstanding                       | -            | -                      | -      |
|                                     | Sacrifice (diminution in the fair value) | -            | -                      | -      |
|                                     | Number of Borrowers                      | -            | -                      | -      |
|                                     | Amount Outstanding                       | -            | -                      | -      |
|                                     | Sacrifice (diminution in the fair value) | -            | -                      | -      |

16. Fixed Assets - Valuation / Revaluation  
The bank has not revaluated the fixed assets. However the depreciation are provide as per below rate;  
Building 10%, Lockers 10%, Machinery 15%, Computer 33%, Furniture and Fixture 10%  
C.C.T.V. Camera 15%, Solar 40%

17. DEAF Scheme 2014 (Rs. in lakh)

|                                                   | 31.03.2025   |               | 31.03.2026   |               |
|---------------------------------------------------|--------------|---------------|--------------|---------------|
|                                                   | No of A/c    | Amount        | No of A/c    | Amount        |
| Opening balance of amount transferred to DEAF     | <b>12727</b> | <b>114.26</b> | <b>13165</b> | <b>126.40</b> |
| Add : Amounts transferred to DEAF during the year | <b>484</b>   | <b>15.00</b>  | <b>456</b>   | <b>11.60</b>  |
| Less : Amounts reimbursed by DEAF towards claims  | <b>49</b>    | <b>2.85</b>   | <b>87</b>    | <b>2.80</b>   |
| Closing balance of amounts transferred to DEAF    | <b>13165</b> | <b>126.40</b> | <b>13534</b> | <b>135.20</b> |



## શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ બેંક લિ., બોટાદ

### પ્રગતિ અહેવાલ

(રૂ.લાખમાં)

| વર્ષ       | થાપણો રૂ. | ધિરાણ રૂ. | શેર ભંડોળ રૂ. | રીઝર્વ ફંડ અને અન્ય ફંડ રૂ. | ચોખ્ખો નફો રૂ. | ડિવીડંડ ટકા | ઓડીટ વર્ગ |
|------------|-----------|-----------|---------------|-----------------------------|----------------|-------------|-----------|
| ૩૧-૦૩-૨૦૨૦ | ૪૪૭૫.૮૩   | ૧૬૨૪.૧૮   | ૭૨.૪૩         | ૧૮૬૩.૪૭                     | ૮૭.૫૫          | -           | બ         |
| ૩૧-૦૩-૨૦૨૧ | ૪૮૭૬.૮૮   | ૧૫૭૮.૮૫   | ૬૮.૮૧         | ૨૦૨૬.૬૩                     | ૮૦.૩૬          | -           | બ         |
| ૩૧-૦૩-૨૦૨૨ | ૫૪૩૩.૦૨   | ૧૭૫૪.૩૩   | ૭૬.૫૨         | ૨૦૫૦.૨૮                     | ૮૫.૨૦          | ૮%          | બ         |
| ૩૧-૦૩-૨૦૨૩ | ૫૭૧૭.૪૬   | ૧૮૫૭.૬૮   | ૮૫.૬૬         | ૨૨૩૮.૬૬                     | ૮૭.૫૧          | ૮%          | બ         |
| ૩૧-૦૩-૨૦૨૪ | ૫૬૫૨.૮૫   | ૨૦૩૪.૫૫   | ૮૩.૮૨         | ૨૩૫૦.૮૪                     | ૮૮.૦૫          | ૮%          | બ         |
| ૩૧-૦૩-૨૦૨૫ | ૫૭૬૦.૬૦   | ૧૮૭૨.૭૫   | ૮૭.૮૬         | ૨૪૧૧.૧૮                     | ૧૦૫.૨૪         | ૮%          | બ         |
| ૩૧-૦૩-૨૦૨૬ | ૫૭૭૮.૭૪   | ૨૦૫૫.૮૩   | ૧૦૩.૪૫        | ૨૫૪૬.૧૨                     | ૧૦૬.૨૮         | ૬%          | બ         |

### આપના ગ્રાહકોને જાણો (KYC) નિયમોનું પાલન કરવા

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આપેલ માર્ગદર્શક સુચનાઓ અનુસાર બેંકની ગ્રાહકોની ઓળખનીતિ ફરજિયાત બનાવી છે. કે જેથી બધા જ ગ્રાહકને જાણો (KYC) નિયમોના પાલનકર્તા બને. તેથી નીચે દર્શાવેલ પુરાવા દરેક ખાતેદારોએ બેંકમાં રજુ કરવા.

### :: બેંકમાં આપવાના થતા દસ્તાવેજી પુરાવા ::

|                                                               |
|---------------------------------------------------------------|
| ૧. પાસપોર્ટ સાઈઝના બે તાજેતરના કલર ફોટા                       |
| ૨. ઓળખની સાબિતી માટે નીચેનામાંથી કોઈપણ એક પુરાવાની નકલ        |
| ★ ભારત સરકારનું પાન કાર્ડ                                     |
| ★ ભારત સરકારનું ચુંટણી કાર્ડ                                  |
| ★ પાસપોર્ટ                                                    |
| ★ ડ્રાઈવિંગ લાયસન્સ ( ફોટા સાથેનું)                           |
| ★ યુનિક આઈ.ડી.કાર્ડ (આધાર કાર્ડ)                              |
| ૩. સરનામાના પુરાવા માટે નીચેનામાંથી કોઈપણ એક પુરાવાની નકલ     |
| ★ લાઈટ બીલ                                                    |
| ★ ટેલીફોન બીલ                                                 |
| ★ રેશન કાર્ડ                                                  |
| ★ જો પેઢી રજીસ્ટર કરાવેલ હોય તો રજીસ્ટ્રેશનની નકલ / પેઢીનામું |

બેંકના તમામ ખાતેદારોને નમ્ર વિનંતી કે, ઉપર જણાવ્યા પ્રમાણેના જરૂરી દસ્તાવેજો હજી બેંકમાં હજુ સુધી રજુ ન કર્યા હોય તો તાત્કાલિક આ દસ્તાવેજો રજુ કરવાની નોંધ લેશો. ઉપર મુજબના દસ્તાવેજો રજુ નહી કર્યા હોય તો રીઝર્વ બેંકના KYC નિયમો પ્રમાણે ખાતા નિષ્ક્રિય કરી ખાતામાં કોઈપણ જાતની લેવડ દેવડ કરવા દેવામાં આવશે નહીં. તથા પેમેન્ટ માટે રજુ થયેલા ચેકો રીઝર્વ બેંકના KYC નિયમો અનુસરેલા નહીં હોવાનું જણાવી પરત કરવામાં આવશે જેમાં બેંકની કોઈ જવાબદારી રહેશે નહીં.

બેંકમાં મુકેલ રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીની વ્યક્તિગત થાપણો ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા વિમાથી સુરક્ષીત છે.

### :: આપણી બેંકનો ધ્યેય ::

જાહેર સંસ્થા એટલે લોકોની મંજૂરી અને લોકોના નાણાંથી ચાલતી સંસ્થા છે. જો તે સંસ્થાને પ્રતિવર્ષે મળતી નફાની રકમ જે તે સંસ્થાની લોકપ્રિયતા અને તેના સંચાલકોની પ્રમાણિકતાની કસોટી છે દરેક સંસ્થાએ આ કસોટી પર ચડવું જોઈએ તેવો મારો આગ્રહ છે.

- મહાત્મા ગાંધી

## જામીન થનાર દરેક સભાસદોએ જામીન તરીકે જવાબદારી માટે ખાસ સમજવા અને ધ્યાનમાં રાખવા જેવું.

૧. જામીન થનાર બેન્કના સભ્ય હોવા જરૂરી છે, અને બેન્કના નિયમો બંધનકર્તા રહેશે.
૨. કોઈપણ જામીન કોસ જામીન થઈ શકશે નહીં.
૩. જામીન થનાર સભાસદે એ પણ જાણવું જરૂરી છે કે કરજ લેનારના જામીન થયા છે તે માટે કરજદારના તમામ પ્રકારના કરજની વ્યાજની રકમ વ્યાજ અને ખર્ચા સહિત બેન્કની થતી કુલ રકમ જામીન પાસેથી વસુલ લેવા બેન્કને અધિકાર છે. ફાળે પડતી જવાબદારીની માન્યતા ભુલ ભરેલી છે.
૪. જામીન થયા પછી કરજદાર લોન ભરવામાં નિષ્ફળ જાય અને લવાઈ હુકમ નામું થાય તેવા કિસ્સામાં હુકનામાની રકમ વ્યાજ અને અન્ય ખર્ચ યુક્તે વસુલ ન આવે ત્યાં સુધી જામીન થનાર પણ લોન લેવાને પાત્ર નથી, આ હકીકતને ધ્યાનમાં રાખીને જામીન થવું.
૫. જામીન થનાર સભાસદને ફોર્મમાં પોતાની સ્થાવર જંગમ મિલ્કત કે કોઈપણ પ્રકારની સીક્યુરીટી દર્શાવી નહીં શકે છતાં પણ આવી નહીં જાહેર કરાયેલી મિલ્કત કે સીક્યુરીટી ઉપર જામીન થયા બાદ જામીનગીરી પેટેનું સઘળું લેણું લેવા બેન્ક અધિકારી છે. અને આવું લેણું જામીન હયાત ન હોય તો તેના વારસદાર પાસેથી પણ વસુલ લેવા બેન્ક હક્કદાર છે.

## સાર્વજનિક (જહેર) ટ્રસ્ટની થાપણો સ્વીકારવા બાબત

બેન્કને ગુજરાત સરકારશ્રીના તા.૦૪-૧૧-૧૯૮૧ ના પત્ર ક્રમાંક નં. બી.પી.ટી. કેપીટલ ૧૦૮૧/૧૧/૨૫૪૭૫/ઈ મુજબ સાર્વજનિક ટ્રસ્ટો પાસેથી થાપણો સ્વીકારવાની પરવાનગી મળેલી છે, જેથી દરેક સભાસદશ્રી જ કોઈ ટ્રસ્ટો સાથે સંકળાયેલા હોય તે ટ્રસ્ટોને આ બેન્કમાં નાણાં રોકવા ભલામણ કરે તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધુ વ્યાજ મેળવે.

### સભાસદોને વિનંતી

- ◆ આપણી બેન્કનું તમામ કામકાજ કોમ્પ્યુટર દ્વારા થાય છે, ખાતેદારોએ તેમના ખાતામાં ચેક અથવા રોકડા નાણાં જમાં કરાવે ત્યારે પોતાનો નંબર સ્પષ્ટ અક્ષરોમાં લખવો જરૂરી છે. જેથી યોગ્ય ખાતામાં રકમ જમાં થઈ શકે.
- ◆ સેવીંગ્સ ખાતેદારોએ પાસબુક અવશ્ય સાથે લાવવી, બાકીના તમામ ખાતાઓની પાસબુક કોમ્પ્યુટર સ્ટેટમેન્ટથી જ્યારે જરૂરી હશે ત્યારે મળી જશે.

### ધિરાણ મેળવતા સભાસદોને ખાસ વિનંતી

- ◆ બેન્કનું ધિરાણ મેળવતા તમામ સભાસદોના ખાતામાં દર માસે નિયમીત વ્યાજ ઉધારવામાં આવે છે, જે વ્યાજ દરેક સભાસદોએ ત્યાર પછીના ૧૫ દિવસમાં ભરવું ફરજિયાત છે, જે મુજબ નિયમીત વ્યાજ ભરવા વિનંતી.
- ◆ હાઈપોથીકેશન અને એન.એચ.પી. ખાતામાં દર મહીને નિયમીત સ્ટોક સ્ટેટમેન્ટ આપવા ફરજિયાત છે, એ હકીકતને ધ્યાનમાં રાખવી દર મહીને સ્ટેટમેન્ટ બેન્કમાં રજુ કરી સહકાર આપવો તેમજ વીમાં પોલીસી પણ રજુ કરવી ફરજિયાત છે અને પુરો થાય તો રીન્યુ કરાવી પોલીસી બેન્કમાં રજુ કરવા નોંધ લેવી.
- ◆ દરેક સભાસદોને વ્યાજ ભરવા માટે કે સ્ટોક - સ્ટેટમેન્ટ માટે રીમાઈન્ડર ન કરવા પડે તેની ખાસ તકેદારી રાખવા વિનંતી, કારણ કે અનિયમીત રીતે વ્યાજ ભરનાર અને સ્ટોક સ્ટેટમેન્ટ સમયસર ન આવે તેવા ખાતાઓની લીમીટ ઉપર તેની સીધી અસર ન થાય તે રીતે સહકાર આપવા વિનંતી.

**ઈશ્વરે આપને સમૃદ્ધિ બક્ષેલી છે, તેની સુરક્ષા કરવી એ આપના હાથની વાત છે અને તે આ બેન્ક કરી આપે છે.**



# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો. ઓપ લેંક લિ., બોટાદ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા પેટા નિયમમાં સુચવેલ સુધારો તથા નવા પેટા નિયમનો ઉમેરો

| પેટા નિયમ નંબર     | જુના પેટા નિયમ                                                                                                                                                             | સુધારા બાદ નવા પેટા નિયમ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | સુધારાનું કારણ                                                                                                                                   |
|--------------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 3                  | બેન્કનું કાર્યક્ષેત્ર બોટાદ તાલુકા પુરતુ મર્યાદિત રહેશે. આ બાબતમાં કોઈ સુધારો કરતા પહેલા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની તેમજ રજીસ્ટ્રારશ્રીની લેખીત મંજૂરી મેળવવી આવશ્યક રહેશે. | બેન્કનું કાર્યક્ષેત્ર બોટાદ જિલ્લા પુરતુ મર્યાદિત રહેશે. આર.બી.આઈ.દ્વારા જારી કરેલ ધ્રાન્ય ઓથોરાઈઝેશનમાં નોર્મ્સનું પાલન થતુ હશે અને પુરતા પ્રમાણમાં હેડરમ કેપીટલ હશે તો એક ફાઈનાન્સીયલ વર્ષ દરમિયાન બેંક તેના સ્ટેટ ઓફ રજીસ્ટ્રેશનના પોતાની પસંદગીના બોટાદ ઉપરાંતના વધુમાં વધુ ત્રણ ડિસ્ટ્રીક્ટ(અમદાવાદ, રાજકોટ, ભાવનગર) ને કાર્યક્ષેત્રમાં ઉમેરી શકશે જેના માટે આર.બી.આઈ.ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. પરંતુ જો ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રણ ડિસ્ટ્રીક્ટથી વધુ ડિસ્ટ્રીક્ટને કાર્યક્ષેત્રમાં ઉમેરવાના હશે તો આર.બી.આઈ.ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. | આર.બી.આઈ.ના તા.૨૮/૧૧/૨૦૨૫ના ધ્રાન્ય ઓથોરાઈઝેશનના પરિપત્રના પેરા-૧૪નું પાલન કરવા તથા વહીવટી અનુકુળતા માટે તેમજ બેંકના કામકાજનું વિસ્તરણ કરવા માટે |
| નવો પેટા નિયમ નંબર | જુના પેટા નિયમ                                                                                                                                                             | નવો પેટા નિયમ                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | નવા પેટા નિયમ ઉમેરાનું કારણ                                                                                                                      |
| ૫(૨૫)              | ----                                                                                                                                                                       | સરકારશ્રીના અભીગમ મુજબ સહકારી બેંકના સભાસદો, ગ્રાહકો, બેંકમાંથી ઈન્સ્યુરન્સની સુવિધા મેળવી શકે તે સારૂ બેંકને ઈન્સ્યુરન્સ કોર્પોરેટ એજન્ટની કામગીરીની મંજૂરી આપવા.                                                                                                                                                                                                                                                                                                                                                                                       | સભાસદો, ગ્રાહકોને ઈન્સ્યુરન્સની સુવિધા આપવા                                                                                                      |

## બેન્કના ખાતેદારો અને ધિરાણ લેતા સભાસદોને ખાસ સુચના

- (૧) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કના તમામ ખાતેદારો તથા ધારકો માટે “તમારા ગ્રાહકોને ઓળખો” (KYC Norms) લાગુ પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ખાતેદારના ફોટા, ઓળખનો આધાર તથા રહેણાંકનો પુરાવો વગેરે નિયમાનુસાર જે શાખામાં ખાતુ ધરાવતા હોય ત્યાં રજુ કરવા ખાસ સુચના છે. અન્યથા બેન્કને આવા ખાતાઓના વ્યવહારો સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી.
- (૨) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ કોઈપણ પ્રકારના થાપણ ખાતામાં છેલ્લા દસ વર્ષથી વ્યવહાર થયેલ ન હોય તેવા તમામ પ્રકારના ખાતાઓની રકમ “ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) સ્કીમ - ૨૦૧૪” ખાતે દર માસે રિઝર્વ બેન્કમાં ટ્રાન્સફર થતી હોય આપના ખાતામાં KYC ની પુર્તતા કરી ખાતામાં લેવડ દેવડ કરવી.
- (૩) બેંકના બાંધી મુદત, થાપણ પર વાર્ષિક રકમ રૂ. ૫૦,૦૦૦ કે તેનાથી વધારે વ્યાજ તેમજ TDS ન કપાય તે માટે થાપણદારે પાનકાર્ડની નકલ તેમજ ફોર્મ નં ૧૨૧ નાણાકીય વર્ષની શરૂઆત બેન્કમાં આપવું જરૂરી છે. પાનકાર્ડ ન ધરાવતા થાપણદારને ઈન્કમેટેક્સના નિયમો મુજબ ૨૦% લેખે TDS કપાતો હોય વહેલામાં વહેલી તકે બેન્કમાં પાનકાર્ડની નકલ જમા કરાવવી. સીનીયર સીટીઝન માટે રૂ. ૧,૦૦,૦૦૦ કે તેનાથી વધારે વ્યાજની રકમ પર ૧૦% TDS લાગુ પડે છે.
- (૪) બેન્કમાં લોકર્સની સુવિધા ખુબ જ વ્યાજબી ભાડાથી ઉપલબ્ધ છે. જે લોકર ધારકની ચાવીમાં બેન્કનું નામ લખાયેલ નથી. તેઓએ બેન્કમાં રૂબરૂ આવી ચાવી ઉપર બેન્કનું નામ લખાવી લેવું.
- (૫) બેન્કમાં તમામ ગ્રાહકોએ તેમના સરનામાં અને ટેલીફોન નંબરમાં થયેલ ફેરફાર અંગેની જાણકારી બેન્કમાં અવશ્ય રજુ કરવી. જે ખાતેદારોએ પોતાના વારસદારની નિમણુંક કરેલ ન હોય તેઓએ વારસદારની નિમણુંક માટેના જરૂરી ફોર્મ મેળવી વારસદારની નિમણુંક કરવી. જેથી હયાતી બાદ વારસદારોને સુગમતા રહે.
- (૬) જે સભાસદો તેમના શેર સર્ટીફિકેટ હજુ સુધી લઈ ગયા નથી. તેઓએ તેમના શેર સર્ટીફિકેટ બેન્કમાંથી સત્વરે મેળવી લેવા.
- (૭) બેન્કમાંથી કેશ કેડીટ લેનાર સભાસદોની સગવડતા ખાતર કેશ કેડીટ ખાતાની પાકતી તારીખની જાણ કરવામાં આવે છે. પરંતુ કોઈ કારણસર જાણ ન થઈ શકે તે માટે બેન્ક જવાબદાર નથી. કેશ કેડીટ લીધા બાદ લોન ખાતામાં પુરતુ ટર્નઓવર નહી કરનાર કેશ કેડીટ સગવડ બેન્ક બંધ કરી શકે છે.
- (૮) કેશ કેડીટ હાઈપોથીકેશન ધિરાણ લેનાર સભાસદોએ દર માસની ૩૦ કે ૩૧ તારીખના બંધ સ્ટોકનું પત્રક પછીના માસની ૧૦ તારીખ સુધીમાં બેન્કમાં રજુ કરવું ફરજિયાત છે. સમયસર સ્ટોક પત્રક નહી આવે તો તેવા ખાતાઓના ચેક બેલેન્સ હોવા છતાં રીટર્ન કરવામાં આવશે. નિયમ પ્રમાણે બેન્કે સ્ટોક ચેકીંગની વ્યવસ્થા કરેલ છે. તે વખતે કેશ કેડીટ ખાતામાં ઉપાડ સામે પુરતો સ્ટોક નહી હોય તો લીમીટ ઘટાડવામાં આવશે.
- (૯) ધિરાણ બાબતમાં જામીનોએ સમજી વિચારીને જામીન થવું જોઈએ. બેન્કમાં ધિરાણ લેનાર અને બે જામીનો પૈકી ત્રણ વ્યક્તિમાંથી સધ્ધરતાવાળી વ્યક્તિ ઉપર બેન્ક કાયદેસરના પગલા લઈ ધિરાણ વસુલ કરી શકે છે. આમાં જવાબદારી વહેંચાતી નથી. તે માટે સભાસદની યોગ્યતા લક્ષમાં લઈ જામીન થાઓ. કરજ વસુલાત માટે કરજ લેનાર અને જામીન થનાર સંયુક્ત તેમજ વ્યક્તિગત રીતે જવાબદાર છે.
- (૧૦) આપના તમામ ખાતાઓમાં નોમીનેશન કરાવવું તેમજ દરેક ખાતેદારોએ પોતાના મોબાઈલ નંબર અપડેટ કરાવવા જરૂરી હોય આપના ખાતામાં બેંકે રૂબરૂ આવી કરાવી જશો.

સભાસદશ્રીઓને બેન્ક તરફથી જાણે  
અજાણે કોઈપણ પડેલ તકલીફ બદલ ક્ષમા-ચાચના  
અને ગત વર્ષમાં આપેલ સુંદર સહકાર બદલ



# આભાર અને હાર્દિક શુભેચ્છાઓ સાથે



શ્રી ધર્મેન્દ્રકુમાર પી. વડોદરીયા  
ચેરમેનશ્રી

શ્રી ભુપતરાય ડી. શાહ  
વાઈસ ચેરમેનશ્રી

:: બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ::

શ્રી અનિલભાઈ કે. શેઠ

શ્રી પ્રતિકભાઈ જે. વડોદરીયા  
શ્રી ભરતભાઈ એન. ગોપાણી  
શ્રી અલ્કેશભાઈ ટી. શેઠ  
શ્રીમતી ધ્વનિબેન ડી. વડોદરીયા  
શ્રી નચીકેતભાઈ જી. વડોદરીયા

શ્રી હસમુખભાઈ એસ. શાહ  
શ્રી સુધીરભાઈ એચ. વાઘેલા  
શ્રી દિનેશભાઈ એસ. શાહ  
શ્રી છાયાબેન કે. ચીકાણી  
શ્રી ભાવેશભાઈ બી. શેઠ

**શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.**

“વેપાર ભવન”, ટાવર ચોક, બોટાદ - ૩૬૪૭૧૦.

ફોન : (૦૨૮૪૯) ૨૫૨૨૫૭

E-mail : [bmcoblal1@gmail.com](mailto:bmcoblal1@gmail.com) • Web : [www.sbmbbl.bank.in](http://www.sbmbbl.bank.in)

# શ્રી બોટાદ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.

“વેપાર ભવન”, ટાવર ચોક, બોટાદ - ૩૬૪૭૧૦.

ફોન : (૦૨૮૪૯) ૨૫૨૨૫૭

E-mail : bmcoblal1@gmail.com • Web : www.sbmbl.bank.in

## :: થાપણો ઉપર વ્યાજના આકર્ષક દર ::

તા.૦૫-૦૬-૨૦૨૦થી અમલમાં...

|                            | નોર્મલ | સીની.સીટીઝન |
|----------------------------|--------|-------------|
| ૧૫ દિવસથી ૪૫ દિવસ સુધી     | ૩.૫૦%  | ૩.૫૦%       |
| ૪૬ દિવસથી ૯૦ દિવસ સુધી     | ૪.૫૦%  | ૪.૫૦%       |
| ૯૧ દિવસથી ૧૮૦ દિવસ સુધી    | ૪.૫૦%  | ૪.૫૦%       |
| ૧૮૧ દિવસથી ૧ વર્ષની અંદર   | ૫.૫૦%  | ૬.૦૦%       |
| ૧ વર્ષથી ૩ વર્ષની અંદર     | ૬.૦૦%  | ૬.૫૦%       |
| ૩ વર્ષથી ઉપર ૫ વર્ષની અંદર | ૫.૫૦%  | ૬.૦૦%       |
| ૫ વર્ષથી ઉપર               | ૫.૫૦%  | ૬.૦૦%       |

સીનીયર  
સીટીઝનને  
અડધો ટકો વધારે  
વ્યાજ આપવામાં  
આવે છે.

વીજબીલો  
સ્વીકારવામાં આવે છે.  
તેમજ NEFT/RTGS ની  
સેવા ઉપલબ્ધ છે.

ફીક્સ ડિપોઝીટ  
AUTO RENEW  
સુવિધા  
ઉપલબ્ધ છે.

રૂા.૫,૦૦,૦૦૦/-  
સુધીની  
થાપણ વિમા દ્વારા  
સુરક્ષીત છે.

QR  
code  
ફેસેલીટી  
ઉપલબ્ધ છે

## :: ગૃહ લક્ષ્મી ::

| ગૃહ લક્ષ્મી :: | ૧ વર્ષ | ૨ વર્ષ | ૩ વર્ષ | ૪ વર્ષ | ૫ વર્ષ |
|----------------|--------|--------|--------|--------|--------|
| રૂા.૧૦૦૦/- ના  | ૧૦૬૧   | ૧૧૨૬   | ૧૧૭૮   | ૧૨૪૪   | ૧૩૧૪   |
| સીનીયર સીટીઝન  | ૧૦૬૭   | ૧૧૩૮   | ૧૧૯૬   | ૧૨૬૯   | ૧૩૪૭   |

શ્રી ધર્મેન્દ્રકુમાર પી. વડોદરીયા  
ચેરમેનશ્રી

શ્રી ભુપતરાય ડી. શાહ  
વાઈસ ચેરમેનશ્રી

## :: બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ::

શ્રી અનિલભાઈ કે. શેઠ

શ્રી પ્રતિકભાઈ જે.વડોદરીયા  
શ્રી ભરતભાઈ એન. ગોપાણી  
શ્રી અલ્કેશભાઈ ટી. શેઠ  
શ્રીમતી ધ્વનિબેન ડી. વડોદરીયા  
શ્રી નચીકેતભાઈ જી.વડોદરીયા

શ્રી હસમુખભાઈ એસ.શાહ  
શ્રી સુધીરભાઈ એચ.વાઘેલા  
શ્રી દિનેશભાઈ એસ.શાહ  
શ્રી છાયાબેન કે. ચીકાણી  
શ્રી ભાવેશભાઈ બી. શેઠ

આપણો ગ્રાહક... એજ સાચો માલીક છે...